રોશન કરો ભવિષ્ય

વર્લ્ડ ઇનબોક્સ

• માર્ચ- 2017

સ્પર્ધાત્મક પરીક્ષા વિષયક મેગેઝિન.

UPSC, GPSC, PSI, CONSTABLE, TET, TAT, BANK EXAM (PO-CLERK), RRB, SSC, AIR-FORCE, NAVY, NDA, MBA

ગુજરાતી વ્યાકરણ

ના અગાઉની પરીક્ષામાં

550+

પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નો

VISIT…

LANZAROTE Caliente.com

ગુજરાતી વ્યાકરણના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો

1. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
   હાથ મસ્તક પર હોવા
   A) મારવા માટે હાથ ઉપાડવો
   B) હાથથી માથું દબાવવું
   C) કૃપા કે મહેરબાની હોવી
   D) મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી
2. પૃથ્વી છંદમાં ....અક્ષરો હોય છે.
   A) 17
   B) 19
   C) 21
   D) 31
3. સંધિ જોડો.
   ધનુસ્ + ધર
   A) ધનુધર
   B) ધર્નુધર
   C) ધનુર્ધર
   D) ધનુધર્ર
4. નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો.
   A) મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું
   B) કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ
   C) પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી
   D) ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા
5. 'આગે આગે ગોરખ જાગે' કહેવતનો અર્થ શું થાય ?
   A) ગોરખનાથ આખી રાત જાગે
   B) કાલની ચિંતા આજે ન કરવી
   C) આગળ જઈને ભીક્ષા માગો
   D) ગોરખનાથ આગ લગાવે છે
6. 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.
   A) અંકોડો
   B) પરિણામ
   C) દાબ
   D) બાદ
7. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
   જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર
   A) પ્રખરવાદી
   B) રૂઢિચુસ્ત
   C) ઝનૂની
   D) પરંપરાગત

---

1)C, 2)A, 3)C, 4)B, 5)B, 6)C, 7)B.

8. 'પાણી પહેલા પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.
A) દીર્ઘદૃષ્ટિ વાપરવી
B) બંધ બાંધી દેવો
C) ડૂબતો માણસ તરણું પકડે
D) ભવિષ્યવાણી કરવી

9. 'મીનીટ' શબ્દની સાચી જોડણી લખો.
A) મિનિટ
B) મિનીટ
C) મીનિટ
D) મીનીટ

10. 'અનેકાનેક' શબ્દની સંધિ છોડો.
A) અને+કાનેક
B) અનેક+એક
C) અને+અનેક
D) અનેક+અનેક

11. 'દુકાળ' સમાસનો પ્રકાર લખો.
A) બહુવ્રીહિ
B) કર્મધારય
C) ઉપપદ
D) મધ્યમપદલોપી

12. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.
આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો.
A) આ
B) માં
C) જ
D) એક

13. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
A) પિતા-પિતૃત્વ
B) માલિક-માલકણ
C) વિદ્વાન-વિદ્વત્તા
D) ચોર-ચોરી

14. વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારું શિક્ષણ આપવું એટલે..........
A) તાલીમ
B) છટણી
C) ભરતી
D) માહિતી પ્રેષણ

15. નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો.
પગ ભાંગી પડવા
A) ફેક્ચર થવું
B) ગળગળા થઈ જવું
C) હિંમત ખૂટી જવી
D) શ્રમ કરતા થાકી જવું

16. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
પોતાની જાતને છેતરવી તે
A) આત્મશ્લાઘા
B) આત્મ વંચના
C) આત્માવાદ
D) આધ્યાત્મ

---

8)A, 9)A, 10)D, 11)B, 12)C, 13)B, 14)A, 15)C, 16)B.

17. સંધિ જોડો.
પૌ + અન
A) પવન
B) પાવન
C) પાવક
D) પૌઅન

18. 'પરિણીતા' શબ્દની સંધિ છોડો.
A) પરિ + નીતા
B) પરિ + ણીતા
C) પરિસ્ + નીતા
D) પરિ + નીત

19. 'આગગાડી' સમાસ ઓળખાવો.
A) તત્પુરુષ
B) ઉપપદ
C) મધ્યમપદલોપી
D) દ્વન્દ્વ

20. નીચેનામાંથી કયો શબ્દ 'છેલાબટાઉ'નો પર્યાય નથી ?
A) ચીચો
B) છેલ
C) બંકો
D) મલંગ

21. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ઘરની બાજુની દીવાલ
A) વાડ
B) કરો
C) ભીંત
D) પછાત

22. 'ગીરિધર' શબ્દની સાચી જોડણી લખો.
A) ગીરીધર
B) ગીરિધર
C) ગિરિધર
D) ગિરીધર

23. 'અનુભૂતિ' શબ્દની સાચી જોડણી લખો.
A) અનુભુતિ
B) અનૂભૂતિ
C) અનુભુતી
D) અનુભૂતિ

24. નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.
પહાડોની હારમાળા વચ્ચે દૂર સુધી લહેરાતી નર્મદા દેખાય.
A) ભૂતકૃદંત
B) વર્તમાનકૃદંત
C) ભવિષ્યકૃદંત
D) વિધ્યર્થકૃદંત

25. ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યું ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ?
A) વ્યતિરેક
B) વ્યાજસ્તુતિ
C) રૂપક
D) ઉપમા

---

17)B, 18)A, 19)C, 20)A, 21)B, 22)C, 23)D, 24)B, 25)B.

26. અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ?

A) શાર્દૂલવિક્રીડિત B) મનહર

C) પૃથ્વી D) સ્ત્રગ્ધરા

27. 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

A) સંઘર્ષ B) ઉન્નતિ

C) ઉન્મેષ D) ઉદાર

28. નીચેના રૂઢિપ્રયોગનો ખરો અર્થ બતાવો : 'મોટા પેટના હોવું.'

A) ઉદાર મનના હોવું B) એક સમયે ઘણું ખાઈ શકવું

C) આસાનીથી દાન દઈ શકે તેવા હોવું D) ખાઉધરા હોવું

29. નીચેનામાંથી કઈ પંક્તિ 'મંદાક્રાન્તા' છંદની છે ?

A) પુષ્પે પાને વિમલ હિમમોતી સરે તેમ છાની .

B) ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું

C) રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ

D) વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ

30. 'ખીલો થઈ જવું' રૂઢિપ્રયોગનો અર્થ શો ?

A) સીધા થઈ જવું B) ડરી જવું

C) શાંત થઈ જવું D) ઊભા રહી જવું

31. 'ઘડિયાળના કાંટા ઉપર હાંક્યા કરે સમય' અલંકાર ઓળખાવો.

A) ઉપમા B) યમક

C) સજીવારોપણ D) રૂપક

32. 'જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી માટેનો સાચો પર્યાયવાચી શબ્દ જણાવો.

A) અમોવન B) અન્નપૂર્ણા

C) અવિકારી D) અખંડ સૌભાગ્યવતી

33. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો 'ધીમેધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય.'

A) શાર્દૂલવિક્રીડિત B) મનહર

C) સવૈયા D) સ્ત્રગ્ધરા

34. નીચેનામાંથી એક વાક્ય ખોટું છે ક્યું ?

A) સફેદ ઘોડો ઘાસ ચરે છે B) ધોળુ કબૂતર ચણે છે

C) ધોળું કબૂતર ઘાસ ચરે છે D) ધોળો ઘોડો ઘાસ ખાય છે

---

26)B, 27)B, 28)A, 29)A, 30)D, 31)C, 32)A, 33)D, 34)C.

35. 'વેવાઈનું રૂપ જુઓ રે બાઈ! કંદર્પ સરીખો લાગે રે' ઉપરોક્ત પંક્તિનો અલંકાર ઓળખાવો.
A) વ્યતિરેક
B) શ્લેષ
C) ઉપમા
D) વ્યાજસ્તુતિ

36. પદક્રમની દ્રષ્ટિએ નીચેના પૈકી કયુ વાક્ય અશુદ્ધ છે ?
A) રસ્તામાં મને કિશોર મળી ગયો
B) મને રસ્તામાં કિશોર મળી ગયો
C) મળી ગયો મને રસ્તામાં કિશોર
D) કિશોર મને રસ્તામાં મળી ગયો

37. 'જોખમ વહોરી લેવું' એવો અર્થ નીચેનામાંથી ક્યા રૂઢિપ્રયોગનો થાય ?
A) ઊંડા પાણીમાં ઊતરવું
B) પવન પ્રમાણે પીઠ ફેરવવી
C) ઉલળ પાણા પડ મારા પગ માથે
D) દેવ જાગી જવા

38. 'મોરના ઈંડા ચીતરવા ન પડે' કહેવતનો સાચો અર્થ શું થાય છે ?
A) મોરનું ઈંડુ કાબરચીતરું હોવાથી તેને ચીતરવાની જરૂર નથી રહેતી
B) વાડ વિના વેલો ન ચડે
C) માતા-પિતાના સંસ્કાર સંતાનમાં આપમેળે ઊતરે
D) મોરનું ઈંડુ અન્ય પક્ષીઓના ઈંડા કરતાં જુદુ હોય છે

39. નીચેના પૈકી કઈ કહેવત 'અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે' એવો અર્થ સૂચવતી નથી ?
A) ખાલી ચણો વાગે ઘણો
B) ખોટો રૂપિયો ચળકે ઘણો
C) ઉજ્જડ ગામમાં વાગે ઢોલ
D) અધૂરો ઘડો છલકાય

40. 'પોતાની જાતને છેતરવી' આના માટે નીચેનો ક્યો શબ્દ બંધ બેસે છે ?
A) આત્મવંચના
B) ભમણા
C) ભ્રાંતિમય
D) કૃતઘ્ન

41. નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
A) આડે લાકડે આડો વેહ-જેવાની સાથે તેવો જ વ્યવહાર થાય.
B) અન્ન તેવો ઓડકાર-જેવો ખોરાક એવા જ વાણીવર્તન થાય.
C) અક્કર્મીનો પડિયો કાણો-કટોકટીમાંથી પાર ઊતરી જવું તે જ ઉત્તમ છે.
D) આભ ફાટે ત્યાં થીગડું ન દેવાય - પાર વગરના દુ:ખોનો કોઈ ઈલાજ હોતો નથી.

42. નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો.
A) રાણીને રાજા સારા છે.
B) રાજા,રાણીને કુંવર બધા સારા છે.
C) રાજા,રાણી ને કુંવર બધા સારાં છે.
D) રાજા ને રાણી સારા છે.

35)D, 36)C, 37)A, 38)C, 39)C, 40)A, 41)C, 42)C.

43. નીચેનામાંથી ક્યો શબ્દ 'પૃથ્વી'નો સમાનાર્થી નથી?"

A) ચપલા B) અવનિ

C) અચલા D) ઈલા

44. 'મુદ્દલ' શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો.

A) ભેટ B) વિક્ષેપ

C) વ્યાજ D) મૂળ

45. 'તિમિર' શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો.

A) અંધકાર B) પ્રકાશ

C) વીજળી D) તમસ

46. 'અરણ્ય' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

A) નિશિથ B) વિપિન

C) ગુલશન D) શર્વરી

47. 'પ્રત્યુત્તર' શબ્દની સાચી સંધિ કઈ ?

A) પ્રત્ય+ઉત્તર B) પ્રત્યુ+અત્તર

C) પ્રત્યઃ+ઉત્તર D) પ્રતિ+ઉત્તર

48. 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાસિક શબ્દ ક્યો છે ?

A) અસીમ B) અપાર

C) અનાદિ D) અનંત

49. 'સંચય' શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ક્યો છે ?

A) વ્યય B) વિધેય

C) વિક્રય D) વિનય

50. નીચેના પૈકી કઈ જોડણી ખરી છે ?

A) પરબિડીયું B) સુશ્રુશા

C) પૂર્ણાહૂતી D) કવયિત્રી

51. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો ?

'નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન'

A) સવૈયા B) દોહરો

C) અનુષ્ટુપ D) ચોપાઈ

---

43)A, 44)C, 45)B, 46)B, 47)D, 48)D, 49)A, 50)D, 51)B.

52. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?

A) વાંકુચૂંકુ
B) વાંકૂચૂકૂ
C) વાંકુંચૂકું
D) વાંકુંચૂંકું

53. નીચેનાં પૈકી કઈ જોડણી ખોટી છે ?

A) પુરાતત્વ
B) માતૃત્વ
C) મહત્ત્વ
D) મમત્વ

54. 'વિશ્વ શાંતિ' કાવ્યના કવિ કોણ છે ?

A) સુન્દરમ્
B) ઉશનસ્
C) સ્નેહરશ્મિ
D) ઉમાશંકર જોશી

55. નીચેનામાંથી કયો શબ્દ 'સમુદ્ર'નો સમાનાર્થી નથી ?

A) કસ્તુભ
B) મકરાલય
C) અદ્રિ
D) અર્ણવ

56. 'અમારી શાળાની આસપાસ બગીચો છે' વાક્યમાં વપરાયેલ સમાસ ઓળખાવો.

A) તત્પુરુષ
B) દ્વન્દ્વ
C) કર્મધારય
D) દ્વિગુ

57. નીચેનામાંથી 'મધ્યમપદલોપી' સમાસ ઓળખાવો.

A) ગર્ભશ્રીમંત
B) માનવસેવા
C) અનુભવજ્ઞાન
D) ચિંતાતુર

58. નીચેના પૈકી કયો શબ્દાલંકાર નથી ?

A) વર્ણાનુપ્રાસ
B) યમક
C) અંત્યાનુપ્રાસ
D) ઉત્પ્રેક્ષા

59. 'મનોહર' શબ્દની સાચી સંધિ કઈ છે ?

A) મન + ઓહર
B) મનસ્ + હર
C) મનુ + હર
D) મનો + હર

60. નવરાત્ર, પંચવટી, ત્રિભુવન-ક્યા સમાસના દ્રષ્ટાંત છે ?

A) દ્વન્દ્વ
B) ઉપપદ
C) મધ્યમપદલોપી
D) દ્વિગુ

61. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?

A) ઝિંદાદિલી
B) ઝીંદાદિલી
C) ઝીંદાદીલિ
D) ઝિંદાદીલિ

---

52)D, 53)A, 54)D, 55)C, 56)B, 57)C, 58)D, 59)B, 60)D, 61)A.

62. 'દયારામનો અક્ષરદેહ' ગ્રંથના રચયિતા કોણ છે ?

A) દયારામ
B) નર્મદ
C) ગો.મા.ત્રિપાઠી
D) દલપતરામ

63. 'પ્રણયોર્મિ' શબ્દની સાચી સંધિ કઈ છે?

A) પ્રણય+ઊર્મિ
B) પ્રણયઃ+ઉર્મિ
C) પ્રણય્+ઊર્મિ
D) પ્રણય્+ઉર્મિ

64. નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

A) કવીશ્વર = કવિ+ઈશ્વર
B) પૂર્વોક્ત = પૂર્વ+ઊક્ત
C) ઉપેન્દ્ર = ઉપ+ઈન્દ્ર
D) રવીન્દ્ર = રવિ+ઈન્દ્ર

65. નીચેનામાંથી કયો શબ્દ 'અગ્નિ'નો પર્યાયવાચી નથી ?

A) અનલ
B) અનિલ
C) કૃશાનુ
D) વહ્નિ

66. નીચેના પૈકી ક્યો શબ્દ 'સુન્દરી'નો સમાનાર્થી નથી ?

A) તન્વી
B) વનિતા
C) કૃશાંગી
D) રામા

67. નીચેના પૈકી ક્યા વિકલ્પમાં વિરૂદ્ધાર્થી શબ્દો નથી?

A) આશીર્વાદ-શાપ
B) ઉષા-સંધ્યા
C) નાગરિક-ગ્રામ્ય
D) અનાવૃષ્ટિ-દુકાળ

68. 'મૂશળધાર' શબ્દનો સમાસ ઓળખાવો.

A) કર્મધારય
B) તત્પુરુષ
C) દ્વિગુ
D) બહુવ્રીહિ

69. ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તાશ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

A) સાતમો કોઠો
B) ત્રેપનમી બારી
C) ઝાકળમાં સૂરજ ઊગે
D) આઠમું પાતાળ

70. 'શર્વિલક' નાટકના કર્તા કોણ છે ?

A) જયંતી દલાલ
B) રસિકલાલ પરીખ
C) ક.મા.મુનશી
D) ચં.ચી. મહેતા

71. નીચેના પૈકી ક્યું જોડકું વિરૂદ્ધાર્થી શબ્દોનું નથી?

A) વિરાટ-વામન
B) અવગુંઠન-આચ્છાદન
C) તેજ-તિમિર
D) શ્લીલ-અશ્લીલ

---

62)C, 63)A, 64)B, 65)B, 66)B, 67)D, 68)D, 69)C, 70)B, 71)B.

72. 'શર્વરી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો ?
A) રજની
B) દિવસ
C) નિશા
D) યામિની
73. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ?
A) મુહુર્ત
B) વાલ્મીકિ
C) ડુગડુગીયું
D) સહાનુભુતિ
74. 'મહાબાહુ અર્જુનને કાબાઓએ લૂંટ્યો.' સમાસ ઓળખાવો.
A) બહુવ્રીહિ
B) તત્પુરુષ
C) ઉપપદ
D) કર્મધારય
75. નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે ?
A) વિચિત્રતા
B) પરિસ્થિતિ
C) રેલ્વે
D) જલદી
76. 'મન્વન્તર' શબ્દની સાચી સંધિ કઈ છે ?
A) મન + અવતાર
B) મનુ + અન્તર
C) મન્વ + અવન્તર
D) મનુ + અવતાર
77. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?
A) નૂકશાન
B) નુકશાન
C) નુકસાન
D) નૂકસાન
78. 'પેટનો ખાડો પૂરવો' એટલે .... રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
A) ખાવું.
B) જીવનનિર્વાહ કરવો.
C) પેટ પૂરતું ખાવું.
D) જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવું.
79. વિરામચિહ્ન મૂકો: જોયું તો ઓજાર બધાં સોનાનાં
A) ?
B) ,
C) !
D) .
80. 'નાદ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
A) મધુર અવાજ
B) કર્કશ અવાજ
C) બુમ
D) ત્રાડ
81. મારા કંઠ માટે શરદી .... પક્ષપાત છે. (ખાલી જગ્યા પૂરો)
A) ની
B) ને
C) નો
D) નું

72)B, 73)B, 74)A, 75)C, 76)B, 77)C, 78)B, 79)C, 80)A, 81)B.

82. સાંબેલા જેવી જાડી ધાર : શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
A) ધોધમાર
B) સાંબેલાધાર
C) મૂશળધાર
D) ધારદાર

83. 'ઉદ્યમ' શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.
A) મહેનત
B) આળસુ
C) મૌસમ
D) ઉદ્વેગ

84. 'શીતળ' શબ્દનો વિરોધી શબ્દ આપો.
A) ઠંડુ
B) નિર્મળ
C) ઉષ્ણ
D) મલિન

85. 'માથામાં રાઈ ભરેલી હોવી' રૂઢિપ્રયોગનો અર્થ શો થાય ?
A) જવાબદારી લેવી.
B) ડહાપણ કરવું.
C) મહેનત નકામી જવી.
D) ખૂબ અભિમાન હોવું.

86. ક્યો સાચો શબ્દકોશ ક્રમ છે તે જણાવો.
A) તડકો, મેળો, પડછાયો, આભ
B) પડછાયો, તડકો, મેળો, આભ
C) આભ, પડછાયો, તડકો, મેળો
D) આભ, તડકો, પડછાયો, મેળો

87. સાચી જોડણી કઈ છે ?
A) ભભુત
B) નીરંજન
C) ભીક્ષા
D) વેશ

88. શત શબ્દનો અર્થ શું થાય ?
A) સત્ય
B) સો
C) શર્ત
D) આમાંથી એકેય નહીં

89. વિભુ એટલે.......?
A) રાત
B) વિભા નામની છોકરી
C) ભગવાન
D) સવાર

90. 'હિમાલય સૌથી ઊંચો પર્વત છે' - આ વાક્યમાં સંજ્ઞા ઓળખો.
A) સૌથી
B) ઊંચો
C) પર્વત
D) હિમાલય
C અને D બંને જવાબ

91. નીચેનામાંથી ક્યો વિકલ્પ વિરોધી શબ્દ સાથેની જોડ દર્શાવે છે?
A) સત્ય-સાચુ
B) સંપ-કુસંપ
C) ટેવ-વર્તન
D) વિચાર-સુવિચાર

82)B, 83)A, 84)C, 85)D, 86)D, 87)D, 88)B, 89)C, 90)C D,91)B.

92. નામના બદલે જે શબ્દ વપરાય તેને શું કહેવાય ?

A) સંજ્ઞા
B) સર્વનામ
C) વિશેષણ
D) ક્રિયાવિશેષણ

93. 'મારું વાગે એ જ નગારું' એટલે ? રૂઢિપ્રયોગ જણાવો.

A) નગારું તો મારુ જ
B) હું કહું તે જ ખરું
C) મારા કરતાં બીજા સારા
D) અન્યની ખોટી વાતો કરવી.

94. 'પગે ચાલીને વસ્તુઓ વેચનાર'... શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો.

A) ફેરિયો
B) લારીવાળો
C) ફકીર
D) વેપારી

95. 'નિષ્ણાત' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?

A) નિપુણ
B) અજ્ઞાત
C) નિષ્ઠાવાન
D) જાજરમાન

96. મોહન ચતુર વિદ્યાર્થી છે. આ વાક્યમાં વિશેષણ કયું છે ?

A) મોહન
B) ચતુર
C) વિદ્યાર્થી
D) છે.

97. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઘોડા ઉપર સવારી કરનાર.

A) ઘોડેસવાર
B) ઘોડાધારી
C) ઘોડાવાળો
D) ઘોડાનો માલિક

98. શબ્દકોશના ક્રમ પ્રમાણે કયું સાચું છે?

A) સરદાર, નામદાર, બિરબલ, અકબર
B) બિરબલ, અકબર, સરદાર, નામદાર
C) અકબર, નામદાર, બિરબલ, સરદાર
D) અકબર, બિરબલ, નામદાર, સરદાર

99. 'પારકી છઠ્ઠીનો જાગતલ' એટલે ?

A) બીજાનું બુરૂ કરનાર
B) બીજા માટે હંમેશા મુશ્કેલીઓ ઊભી કરનાર
C) બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર
D) બીજા માટે સતત છ દિવસ જાગનાર

---

92)B, 93)B, 94)A, 95)A, 96)B, 97)A, 98)C, 99)C.

100. 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો.

A) સબંધક ભૂતકૃદંત
B) ભૂતકૃદંત
C) સામાન્ય કૃદંત
D) ભવિષ્યકૃદંત

101. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો :
માથે લેવું

A) ગુનો કબુલ કરવો
B) માથા પર વજન ઉપાડવું
C) જવાબદારી સંભાળવી
D) જવાબદારીમાંથી છૂટી જવું

102. 'કવિ શિરોમણી'નું માન કોને મળ્યું ?

A) નરસિંહ મહેતા
B) પ્રેમાનંદ
C) નર્મદ
D) દલપતરામ

103. કઈ જોડણી સાચી છે ?

A) પૃથ્થકકરણ, તત્વાર્થ, અદ્ધર, ગદગદિત
B) પૃથ્થકરણ, તત્વાર્થ, અદ્ધર, ગદગદીત
C) પૃથકકરણ, તત્ત્વાર્થ, અધ્ધર, ગદ્દગદિત
D) પૃથ્થકરણ, તત્વાર્થ, અધ્ધર, ગદગદીત

104. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

A) અદીતીય
B) અદ્વિતિય
C) અદ્વિતીય
D) અદવિતય

105. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
બધું જાણનાર

A) અંતર્યામી
B) સંન્યાસી
C) વિદ્વાન
D) સર્વજ્ઞ

106. સમાસ ઓળખાવો : દરરોજ

A) કર્મધારય સમાસ
B) અવ્યવીભાવ સમાસ
C) ઉપપદ તત્પુરુષ સમાસ
D) મધ્યમ પદલોપી સમાસ

107. 'નર્મદા' સમાસ લખો.

A) બહુવ્રીહી
B) ઉપપદ
C) દ્વન્દ્વ
D) મધ્યમપદલોપી

---

100)A, 101)C, 102)B, 103)C, 104)C, 105)D, 106)B, 107)B.

108. 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

A) ડોક
B) વિષ
C) વાસુ
D) વખાણ

109. 'સ્થૂળ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

A) કદાવર
B) સંગમ
C) સુક્ષ્મ
D) દુર્બળ

110. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.

લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા !

A) શંકા
B) જરાય
C) નોહતી
D) તો

B અને D બંને જવાબ

111. લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ?

A) ઉર્મિગીત
B) ગરબી
C) મુક્તક
D) લોકગીત

112. 'ઉત્તરોત્તર' શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ?

A) ઉત્તર + ઉત્તર
B) ઉત્તરો + અત્તર
C) ઉત્તર + ઓત્તર
D) ઉત્તરો + ત્ + તર

113. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.

શાશ્વત -

A) ક્ષણિક
B) કાયમી
C) સ્થાવર
D) હંમેશ માટે

114. નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશના ક્રમમાં છે ?

A) દિવસ, ધીરજ, ભાગ, ઘોડો, દિવાળી
B) ધીરજ, દીવાળી, ભાગ, દીવસ, ઘોડો
C) ઘોડા, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
D) ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

115. નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.

ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય.

A) દ્રષ્ટાંત
B) ઉપમા
C) શ્લેષ
D) સજીવારોપણ

---

108)B, 109)C, 110) B D, 111)D, 112)A, 113)A, 114)C, 115)D.

116. 'યામિની' શબ્દનો સમાનાર્થી શબ્દ :

A) યમની બહેન B) વીજળી

C) સમીક્ષા D) રાત્રી

117. <u>અઢારે</u> વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

A) સંખ્યાવાચક B) રંગવાચક

C) પરિણામવાચક D) ગુણવાચક

118. 'હસતું મોઢું રાખજો' - કૃદંત ઓળખાવો.

A) વર્તમાનકૃદંત B) સામાન્યકૃદંત

C) ભૂતકૃદંત D) ભવિષ્યકૃદંત

119. 'થાપોટ' તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો.

A) ટપલી B) નથણી

C) થરથરાટ D) નઠારું

120. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

A) હિંસા - હિંસક B) તંત્ર - તાંત્રિક

C) પૈસા - પૈસાદાર D) લેખક - લેખિકા

121. શબ્દો અને તેના વિરુદ્ધાર્થી શબ્દોનું કયું જોડકું સાચું છે ?

A) ઉત્કર્ષ x પ્રસન્ન, ઉદાર x પતન, ઉદય x લોભી, ઉદાસ x પતન

B) ઉત્કર્ષ x પ્રસન્ન, ઉદાર x લોભી, ઉદય x અસ્ત, ઉદાસ x પતન

C) ઉત્કર્ષ x લોભી, ઉદાર x પતન, ઉદય x પ્રસન્ન, ઉદાસ x અસ્ત

D) ઉત્કર્ષ x પતન, ઉદાર x લોભી, ઉદય x અસ્ત, ઉદાસ x પ્રસન્ન

122. 'શાર્દૂલ વિક્રીડિત' છંદના ગણનું સૂત્ર દર્શાવો.

A) ય મ ન સ ભ લ ગા B) મ ભ ન ત ત ગા ગા

C) મ સ જ સ ત ત ગા D) ભ ર ભ ન ય ય ય

123. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

A) બીવું - બીક B) સડવું - સડો

C) શોભવું - શોભા D) વળગવુ - વાળગેલું

124. 'કાશીમા કાબરી પાછળ દોડ્યા.' આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

A) કાશીમાથી કાબરી પાછળ દોડાયું B) કાશીમા દોડ્યા અને કાબરી દોડી.

C) કાશીમાથી કાબરી પાછળ દોડાય છે D) એકપણ વિધાન સાચું નથી

---

116)D, 117)A, 118)A, 119)A, 120)D, 121)D, 122)C, 123)D, 124)A.

125. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ

A) હેતુ + આભાસ
B) હેત્ + આભાસ
C) હેતવ + આભાસ
D) હેત્વ + ભાસ

126. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.

ભૂલચૂક માફ કરશોજી

A) માફ
B) કરશો
C) ભૂલચૂક
D) જી

127. 'કાન તળે કાઢી નાખવું' રૂઢિપ્રયોગનો અર્થ :

A) ઠપકો આપવો.
B) કાન વડે ધ્યાનથી સાંભળવું
C) કાન બહેરા થઈ જવા
D) કોઈ વાત પર લક્ષ ન આપવું.

128. નીચેનામાંથી ક્યું ઉદાહરણ વ્યતિરેક અલંકાર છે ?

A) મેરુ રે ડગે ને જેના મન નો ડગે
B) જ્યાં ત્યાં વય બદલી સંતાય જાણે પરીઓ !
C) ઊંઘતાને પાયે જગની જેલ.
D) મહુડા માથા ઉતારતા યોગી જેવા લાગે છે.

129. તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપોના વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ બરાબર નથી ?

A) ગલઢેરા - ઝૂંપડાં
B) હડકે ઠઠ - ભરચક
C) ફાંટ - પોટકું
D) બકાલું - શાકભાજી

130. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર.

A) પત્રકાર
B) લેખક
C) ચોર
D) જાસૂસ

131. 'સરસ્વતીચંદ્ર' નવલકથાના લેખક કોણ હતા ?

A) દલપતરામ
B) ગોવર્ધનરામ ત્રિપાઠી
C) નવલરામ
D) નર્મદ

132. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો :

મતિ મારી જવી

A) સહમતિ ન બતાવવી
B) બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી
C) કંઈ સૂઝવું નહીં
D) બુદ્ધિ ચલાવવી નહીં

133. 'કાળુને તો રાજુની ગાળો ગોળથીયે મીઠી લાગતી હતી.' - અલંકાર ઓળખાવો.

A) ઉપમા
B) અનન્વય
C) વ્યતિરેક
D) વ્યાજસ્તુતિ

---

125)A, 126)D, 127)D, 128)A, 129)A, 130)D, 131)B, 132)C, 133)C.

134. ભક્તિપ્રધાન સાહિત્ય અને તે લખનાર લેખકની જોડીમાંથી કઈ જોડી ખોટી છે ?

A) વલ્લભ ભટ્ટ - આનંદનો ગરબો
B) સહજાનંદ સ્વામી - વચનામૃત
C) ઓખાહરણ - પ્રેમાનંદ
D) સુદામાચરિત્ર - ભોજો

135. 'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત' - આ પંક્તિનો છંદ જણાવો.

A) દોહરો
B) ચોપાઈ
C) અનુષ્ટુપ
D) પૃથ્વી

136. સાચી જોડણી દર્શાવો.

A) ટરમીનશ
B) ટર્મિનસ
C) ટૅમીનસ
D) ટરમીનષ

137. સંતો ! અમે રે વહેવારિયા રામનામનાં - રેખાંક્તિ વિશેષણનો પ્રકાર જણાવો.

A) સંખ્યાવાચક
B) રંગવાચક
C) ગુણવાચક
D) પરિણામવાચક

138. 'ચોખાની ઘેંશ' માટે વપરાતો તળપદો શબ્દ શોધો.

A) પેજ
B) પેદ
C) પેમ
D) પેક

139. 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો.

A) અભિમાનમાં ખરાબ દેખાવ કરે
B) ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
C) સારા ખરાબનો કદી વિચાર ન કરે
D) કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

140. સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો :

A) વાસ - સાથ
B) કપટી - ઠગારું
C) ચૂવું - ટપકવું
D) લાડણી - વહાલી

141. 'બકો ઊભો થયો ને રડવા લાગ્યો.' કૃદંત ઓળખાવો.

A) ભવિષ્ય કૃદંત
B) ભૂત કૃદંત
C) વર્તમાન કૃદંત
D) વિધ્યર્થ કૃદંત

142. આપેલા વિધાનમાં નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.

A) ભારવાચક
B) વિનયવાચક
C) સીમાવાચક
D) વિધાનમાં નિપાત નથી

134)D, 135)B, 136)B, 137)C, 138)A, 139)B, 140)A, 141)D, 142)B.

143. 'પુત્રૈષણા' શબ્દની સંધિ છૂટી પાડો.

A) પુતં + ઐષણા
B) પુત્ર + ઈષણા
C) પુત્ર + ઐષણા
D) પુત્ર + એષણા

144. સાચો સમાનાર્થી શબ્દ શોધો :
સાંઢ

A) ઊંટડી
B) ગોધો
C) ઘોડો
D) ઘોડી

145. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

A) મહત્ત્વાકાંક્ષી
B) મહત્વાકાંક્ષી
C) મહત્વાકાક્ષી
D) મહત્ત્વાકાક્ષી

146. સમાસ ઓળખાવો : 'મહેશ્વર'

A) દ્વિગુ
B) કર્મધારય
C) બહુવ્રીહિ
D) ઉપપદ

147. નીચે આપેલ વાક્યમાંથી વિશેષણ શોધો :
કરુણ ગીતો સાંભળી તે બેસી ગયો.

A) કરુણ
B) ગીતો
C) સાંભળી
D) તે

148. 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી.' - આ ક્યા પ્રકારનું વાક્ય છે ?

A) કર્તરી
B) કર્મણિ
C) વિધ્યર્થ
D) પ્રેરક

149. અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી.'

A) ઉપમા
B) યમક
C) રૂપક
D) અનન્વય

150. સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ'

A) ઉપપદ
B) મધ્યમપદલોપી
C) દ્વન્દ્વ
D) દ્વિગુ

151. 'વિપિન' શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે?

A) બગીચો
B) રાત્રિ
C) ચંદ્ર
D) જંગલ

---

143)D, 144)A, 145)A, 146)B, 147)A, 148)D, 149)D, 150)D, 151)D.

152. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.'

A) પોળ
B) ઓસરી
C) બાલ્કની
D) વંડી

153. નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :

વહેંચી લેવો હા, જન જન મહીં સ્નેહ નકરો !

A) શિખરણી
B) મંદાક્રાન્તા
C) હરિગીત
D) પૃથ્વી

154. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

A) ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ
B) ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ
C) ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ
D) ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ

155. નીચેનામાંથી સાચી સંધિ શોધો : 'સાશ્ચર્ય'

A) સા + શ્ચર્ય
B) સ + ઐશ્ચર્ય
C) સાસ્ + અચર્ય
D) સ + આશ્ચર્ય

156. અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !'

A) ઉપમા
B) રૂપક
C) શ્લેષ
D) ઉત્પ્રેક્ષા

157. નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે?

A) પાણી
B) ઘોડો
C) પાણિ
D) સરોવર

158. છંદ ઓળખાવો :

ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ,
ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ.

A) મનહર
B) અનુષ્ટુપ
C) દોહરો
D) ચોપાઈ

159. 'કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ ક્યો છે?

A) મોં કાળું કરવા કજિયો કરવો
B) કજિયાથી દૂર રહેવું સારું
C) કજિયો કરી મોં ધોવા જવું
D) કજિયો કરનારનું મોં કાળું થાય છે

160. 'ખૂંદી તો <u>પ્રથમી</u> ખમે ....' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો.

A) પહેલું
B) ખોળો
C) પૃથ્વી
D) જમીન

152)D, 153)A, 154)C, 155)D, 156)C, 157)B, 158)C, 159)B, 160)C.

161. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.'

A) અનુસ્યૂત B) અદમ્ય

C) અદ્ભુત D) અભિભૂત

162. 'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે?

A) તાકાતનો પરચો બતાવવો B) હાથ બતાવવો

C) પાણી કેવું છે તે બતાવવું D) પાણીમાંની ગંદકી બતાવવી

163. વિરોધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ'

A) સમષ્ટિ B) સમદૃષ્ટિ

C) વૃષ્ટિ D) દૃષ્ટિ

164. 'ખાલી ચણો વાગે ઘણો' - કહેવતનો સાચો અર્થ કયો છે?

A) ખાલી ચણાથી દૂર રહેવું B) ના બોલ્યામાં નવ ગુણ

C) અલ્પજ્ઞાની વિદ્વત્તાનો ડોળ કરે D) બોલે તે કંઈ ન કરે

165. નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ છે ?

A) આરંભ B) સ્વીકાર

C) મંગલ D) પૌરાણિક

C & D બંને જવાબ

166. નીચેના પૈકી કયા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે નથી ?

A) અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર B) હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રિ, હિંસાત્મક

C) ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ D) માન, મુક્ત, મિત્ર, મૂળ

167. નીચેનામાંથી ગુણવાચક વિશેષણ કયું છે ?

A) કેવડું B) કડવું

C) હજાર D) કયો

168. સાચી જોડણી શોધો.

A) થીયેટર B) મિલિટરી

C) ક્રીકેટ D) ટિકીટ

169. 'પવન પ્રમાણે પીઠ ફેરવવી' - રૂઢિપ્રયોગનો અર્થ લખો.

A) વિરોધ કરવા ફરવું B) પરિસ્થિતિને અનુકૂળ થવું

C) બચાવ માટે હટી જવું D) પવનની દિશામાં દોડવું

170. નવલિકા એટલે ?

A) પ્રવાસ વર્ણન B) નવલકથા

C) નવલકથાનો ખંડ D) ટૂંકી વાર્તા

171. સંધી જોડો : જ્ઞાન + ઈશ્વર ?

A) જ્ઞાનેશ્વર
B) જ્ઞાનિસ્વર
C) જ્ઞાનીશ્વર
D) જ્ઞાનઈશ્વર

172. 'કવિશ્વર' તરીકે ઓળખાતા કવિ ....

A) દયારામ
B) રા.વિ. પાઠક
C) દલપતરામ
D) નવલરામ

173. ખોટી જોડણી શોધો.

A) વિટામીન
B) સર્ટિફિકેટ
C) કંપની
D) સપ્ટેમ્બર

174. 'નિદ્રા આવી જવી' એવો અર્થ ક્યો રૂઢિપ્રયોગ સૂચવે છે ?

A) આંખ મીંચાઈ જવી
B) આંખ ઠેરવવી
C) આંખ મળી જવી
D) આંખ માંડવી

(A & C બંને જવાબ)

175. 'શ્રીરામ એટલે શ્રીરામ.' - અલંકાર ઓળખાવો.

A) રૂપક
B) અનન્વય
C) ઉત્પ્રેક્ષા
D) વ્યાજસ્તુતિ

176. કઈ સંધિનો વિગ્રહ સાચો છે ?

A) ગે + અન = ગાયન
B) સ્વા + આગત = સ્વાગત
C) સમ્ + મતિ = સન્મતિ
D) રામ + અયન = રામાયણ

177. 'લોકસાહિત્ય એટલે લોકજીભે રમતું - લોકકંઠે જીવતું સાહિત્ય' - એવું કોણે કહ્યું છે?

A) ઉમાશંકર જોશી
B) દલપતરામ
C) ઝવેરચંદ મેઘાણી
D) ચિનુભાઈ મોદી

178. ક્યો સમાસ ઉપપદ સમાસ નથી ?

A) તટસ્થ
B) અખૂટ
C) જીવસરખું
D) અનુજ

(B & C બંને જવાબ)

179. ઓ + અ = અવ્ - એ નિયમ નીચેનામાંથી કઈ સંધિ છોડતાં લાગુ પડે છે?

A) પો + અન = પવન
B) ને + અન = નયન
C) પૌ + અન = પાવન
D) નૌ + ઈક = નાવિક

---

171)A, 172)C, 173)A, 174)A C, 175)B, 176)D, 177)A, 178)B C, 179)A.

180. 'પાટણની પ્રભુતા' નવલકથાના લેખક કોણ છે ?

A) અમૃતલાલ વેગડ
B) સારસ્વત
C) પૂનમભાઈ જોશી
D) કનૈયાલાલ મુનશી

181. 'ભોરંગ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.

A) ભોગળો
B) ભંફોડી
C) નાગ
D) રીંગણ

182. 'પતીજ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.

A) ભરોસો
B) પતન
C) પ્રમાણ
D) પોકાર

183. પારસમણિ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

A) શાલીગ્રામ પથ્થર
B) આરસપહાણનો પથ્થર
C) હીરાની પરીક્ષા કરનાર ઝવેરી
D) જેના સ્પર્શથી લોઢું સોનું બને

184. નીચેના પૈકી ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ મુજબ છે ?

A) અવર, ઉનાળો, ઋતુ, ગુજરાતી
B) ગુજરાતી, ઉનાળો, અનન્યા, ઋતુ
C) અવર, અનન્યા, ગુજરાતી, ઉનાળો
D) અનન્યા, અવર, ઉનાળો, ઋતુ

(A & D બંને જવાબ)

185. 'સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે' - આ વાક્યમાંથી સંયોજક શોધો.

A) આપો
B) પણ
C) અને
D) કે

186. નીચેનામાંથી ક્યો શબ્દ 'યુદ્ધ'નો પર્યાય છે ?

A) અશ્મયુગ
B) આકલ્પ
C) અકાસેત
D) રણયજ્ઞ

187. આ + ઈ = એ - નિયમ કઈ સંધિ છોડતા લાગુ પડે છે?

A) મહર્ષિ
B) રજનીશ
C) સુરેશ
D) રમેશ

188. 'ઘરસંસાર' સમાસનો પ્રકાર જણાવો.

A) કર્મધારય
B) દ્વન્દ્વ
C) ઉપપદ
D) તત્પુરુષ

(A & D બંને જવાબ)

---

180)D, 181)C, 182)A, 183)D, 184)A D, 185)D, 186)D, 187)D, 188)A D.

189. ક્યું વિરોધી શબ્દનું જોડકું સાચું છે ?

A) આર્દ્ર x શુષ્ક
B) પોળ x શેરી
C) રસ્તો x પંથ
D) હેત x સ્નેહ

190. 'ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ.' - છંદ ઓળખાવો.

A) હરિગીત
B) સવૈયા
C) શાર્દૂલવિક્રીડિત
D) દોહરો

191. ખંડકાવ્યના જનક કોણ છે ?

A) કવિ સેહની
B) કવિ શેષ
C) કવિ કાન્ત
D) કવિ વાસુકિ

192. 'એક સાંધીએ ત્યાં તેર તૂટે.' - કહેવતનો સાચો અર્થ શોધો.

A) એક કામ કરવા જતાં બીજા દસ કામ બગડે.

B) બરાબર સાંધીએ તો તેર જગ્યાએ ન તૂટે.

C) તીન તીગડા કામ બીગડા

D) એક જગ્યાએ સાંધતાં તેર જગ્યાએ તૂટી જાય છે.

193. ક્યું વિરોધી શબ્દનું જોડકું સાચું નથી ?

A) સાક્ષર x નિરક્ષર
B) નાસ્તિક x આસ્તિક
C) ઉત્તમ x શ્રેષ્ઠ
D) અમર x મર્ત્ય

194. રોળા છંદની ચાર અને ઉલાળા છંદની બે પંક્તિઓ શેમાં જોવા મળે છે?

A) પ્રભાતિયાં
B) ચોપાઈ
C) મુક્તક
D) છપ્પા

195. 'વ્યતિરેક' અલંકારનું ઉદાહરણ ક્યું છે?

A) ગુલાબ લઉં? ના કપોલ તુજ રમ્ય એથી ઘણા.

B) સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હોય.

C) જવાની તો જવાની છે.

D) આ ડોલ પોતાની છે.

196. 'હવાની લહેરનો મંદ અવાજ' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

A) સરસરાહટ
B) ઘરઘરાહટ
C) પર્ણમર્મર
D) ચરચરાટ

189)A, 190)C, 191)C, 192)A, 193)C, 194)D, 195)A, 196)A.

197. 'દાદાજીએ પોતાના જીવનનાં ખટમીઠાં પ્રસંગો અમને કહ્યાં' - લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.

A) મધ્યમપદલોપી
B) દ્વન્દ્વ
C) કર્મધારય
D) દ્વિગુ

198. 'પરીસ્થિતી' શબ્દની સાચી જોડણી લખો.

A) પરીસ્થતી
B) પરીસ્થિતી
C) પરિસ્થતી
D) પરિસ્થિતિ

199. 'સૉનેટ' નામનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ લખનાર લેખક કોણ હતા ?

A) રાજેન્દ્ર શુક્લ
B) ચુનીલાલ મડિયા
C) ચીનુ મોદી
D) હર્ષ બ્રહ્મભટ્ટ

200. જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે .... અલંકાર બને.

A) વ્યાજસ્તુતિ
B) સજીવારોપણ
C) રૂપક
D) શ્લેષ

201. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.
મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે પણ જોઈશે.

A) પણ
B) હોય તો
C) તે
D) તમારા

202. ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

A) પૂર્વરાગ
B) અમૃતા
C) A અને B બંને
D) આપેલ પૈકી એકપણ નહીં

203. 'ખાંડાની ધારે ચાલવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) સુખ દુઃખનો અનુભવ કરવો
B) મુશ્કેલીઓ વધારવી
C) અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું
D) રોમાંચિત થવું

204. નીચેનામાંથી ક્યો છંદ માત્રામેળ નથી ?

A) ચોપાઈ
B) દોહરો
C) પૃથ્વી
D) હરિગીત

---

197)B, 198)D, 199)B, 200)B, 201)A, 202)A, 203)C, 204)C.

205. 'ઓખાહરણ', 'કુંવરબાઈનું મામેરું', 'નળઆખ્યાન' જેવા આખ્યાન આપનાર આખ્યાનકાર કોણ છે?

A) દયારામ
B) દલપતરામ
C) નરસિંહ મહેતા
D) પ્રેમાનંદ

206. 'રમા + ઈશ' શબ્દની સંધિ જોડો.

A) રમાશ
B) રમેશ
C) રેમષ
D) રમૈષ

207. 'નિર્ણય' શબ્દની સંધિ છોડો.

A) નિ + ર્ણય
B) નિ + નય
C) નિ + અર્ણય
D) નિસ્ + નય

208. શેમાં લોકસેવક રવિશંકર મહારાજની અનુભવ કથાઓનું સાહિત્યકાર મેઘાણીએ વાર્તારૂપે નિરૂપણ કર્યું છે?

A) વેવિશાળ
B) સોરઠ તારાં વહેતા પાણી
C) માણસાઈના દીવા
D) કંકાવટી

209. 'સંપ ત્યાં જંપ' કહેવતનો અર્થ જણાવો.

A) સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે
B) સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે.
C) કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય
D) સંપ અને જંપને કદી બનતું નથી.

210. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

છપડી -

A) ગમ્મત
B) અનાદર
C) લુચ્ચાઈ
D) વ્યંગભાવ

211. 'સપૂત' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

A) કાળોપુત્ર
B) કપૂત
C) સારોપુત્ર
D) એકપણ નહીં

212. 'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

A) યક્ષિણી
B) દ્રૌપદી
C) જક્કલાદેવી
D) મૃણાલવતી

213. જેનો પ્રકાર 'નાર' કે 'વાન' છે તેને ક્યા પ્રકારનું કૃદંત કહેશો ?

A) સામાન્યકૃદંત
B) હેત્વર્થકૃદંત
C) વર્તમાનકૃદંત
D) ભવિષ્યકૃદંત

---

205)D, 206)B, 207)D, 208)C, 209)B, 210)C, 211)B, 212)B, 213)D.

214. નરસિંહ મહેતાના પ્રભાતિયા ક્યા છંદમાં લખાયેલા છે ?

A) ચોપાઈ B) ઝૂલણા
C) દુહા D) વસંતતિલકા

215. સાચી જોડણી દર્શાવો.

A) પ્રતિતિ B) પ્રતીતિ
C) પ્રતિતી D) પ્રતીતી

216. 'પ્રકૃતિ જ મારી મા રહી છે' - વાક્યમાં કયું પદ 'નિપાત' છે ?

A) મા B) રહી
C) જ D) છે

217. આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ?
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી'

A) ઉત્પ્રેક્ષા B) વ્યતિરેક
C) ઉપમા D) સજીવારોપણ

218. 'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

A) ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
B) માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
C) મોર સુંદર હોય તેથી.
D) મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

219. 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

A) પતન B) પતિનો મિત્ર
C) વિશ્વાસ D) પ્રમાણ

220. 'કૃતજ્ઞ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

A) કૃતઘ્ન B) ગરિમા
C) કર્મઠ D) અજ્ઞાન

221. 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) લક્ષ્ય ન મળવું B) લક્ષ્ય સાધવું
C) લક્ષ્ય આપવું D) ધ્યેય સિદ્ધ ન થવું

222. માત્રામેળ છંદમાં ક્યો છંદ 28 અક્ષરનો છે ?

A) હરિગીત B) સવૈયા
C) દોહરો D) ચોપાઈ

---

214)B, 215)B, 216)C, 217)C, 218)B, 219)C, 220)A, 221)B, 222)A.

223. 'સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો.

A) સૂ + ઉક્તિ B) સુ + ઉક્તિ

C) સૂ + ઊક્તિ D) સ + ઊક્તિ

224. રેખાંક્તિ સમાસનો પ્રકાર જણાવો.

શ્રીકૃષ્ણ માટે <u>ગિરિધર</u> શબ્દ પણ પ્રયોજાય છે.

A) ઉપપદ B) તત્પુરુષ

C) કર્મધારય D) દ્વિગુ

225. 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો.

A) ઘૂંઘટવાળી B) શ્યામવર્ણવાળી

C) મિથ્યાભિમાની D) તાબે થયેલ

226. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર લખો.

સ્વામીજીએ <u>આવીને</u> અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.

A) હેત્વર્થકૃદંત B) સંબંધક ભૂતકૃદંત

C) ભૂતકૃદંત D) ભવિષ્યકૃદંત

227. નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને જણાવો.

તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

A) માત્ર B) વખત

C) તમારે D) દસ

228. કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

A) ઉમાશંકર નર્મદાશંકર જોશી B) ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી

C) ઉમાશંકર આત્મારામ જોશી D) ઉમાશંકર જેઠાલાલ જોશી

229. 'વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો' - વાક્યમાંનો અલંકાર જણાવો.

A) આંતરપ્રાસ B) અંત્યાનુપ્રાસ

C) વર્ણાનુપ્રાસ D) ઉપમા

230. 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

A) એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા B) કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

C) કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો D) સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

223)B, 224)A, 225)A, 226)B, 227)A, 228)D, 229)A, 230)A.

231. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.

a) પન્નાલાલ પટેલ — 1) ગંગોત્રી
b) ઝવેરચંદ મેઘાણી — 2) તુલસીક્યારો
c) ઉમાશંકર જોશી — 3) રાઈનો પર્વત
d) રમણભાઈ નીલકંઠ — 4) મળેલા જીવ

A) b-4, c-3, d-2, a-1 B) d-3, b-2, c-1, a-4
C) a-2, d-1, b-3, c-4 D) c-2, a-3, d-1, b-4

232. 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

A) નીતિ B) સ્તુતિ
C) નિમિત્ત D) ભાગ્ય

233. 'સર્જન' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

A) સંસ્કારી B) ડોક્ટર
C) લીલા D) સંહાર

234. રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.
'બે પાંદડે થવું'

A) આર્થિક સ્થિતિ સારી થવી B) પાંદડા બે થવા
C) એકના બે થઈ જવું D) બેમત ના હોવું

235. સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો 'બાલ સાહિત્ય પુરસ્કાર - 2016' કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?

A) હરિકૃષ્ણ પાઠક B) રૂષિરાજ જાની
C) પુષ્પા અંતાણી D) ધીરુબેન પટેલ

236. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.

A) દોહરો B) ચોપાઈ
C) હરિગીત D) સવૈયા

237. સંધિ જોડો.
સુ + અલ્પ

A) સુઅલ્પ B) સ્વલ્પ
C) સ્વાલ્પ D) સ્વલપ

---

231)B, 232)D, 233)D, 234)A, 235)C, 236)A, 237)B.

238. સંધિ જોડો.
સિન્ધુ + ઊર્મિ
A) સિંધુઊર્મિ
B) સિંધઊર્મિ
C) સિંધુઉર્મા
D) સિન્ધૂર્મિ

239. નીચે આપેલા સમા અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?
A) નખશિખ-બહુવ્રીહિ
B) પંકજ-તત્પુરુષ
C) ટાઈમટેબલ-દ્વન્દ્વ
D) ત્રિકાળ-ઉપપદ

240. 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.
A) નાહકની વહોરેલી પીડા
B) અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
C) વણસેલા સંબંધો
D) સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

241. પ્રસિદ્ધ કાવ્ય 'કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' ના સર્જકનું નામ જણાવો.
A) રમણભાઈ નીલકંઠ
B) આનંદશંકર ધ્રુવ
C) મણિલાલ નભુભાઈ
D) સ્વામી આનંદ

242. નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
<u>લખવું વાંચવું</u> એ કંઈ કેળવણી નથી.
A) વિધ્યર્થકૃદંત
B) સંબંધકકૃદંત
C) ભવિષ્યકૃદંત
D) વર્તમાનકૃદંત

243. સાચી જોડણી દર્શાવો.
A) યુનિવર્સિટી
B) યુનીવર્સીટી
C) યૂનીવર્સિટી
D) યુનિવર્સીટી

244. સમાસ ઓળખાવો : ટપાલપેટી
A) મધ્યમપદલોપી
B) તત્પુરુષ
C) ઉપપદ
D) બહુવ્રીહિ

245. આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચણી પહેરી હતી.
A) તેણે
B) વાદળી
C) ચણી
D) હતી

246. સમાનાર્થી શબ્દ લખો : 'અનુજ્ઞા'
A) હુકમ
B) પરવાનગી
C) આજ્ઞા
D) અવજ્ઞા

---

238)D, 239)A, 240)D, 241)C, 242)A, 243)A, 244)A, 245)B, 246)B.

247. અલંકાર ઓળખાવો : નિસર્ગના મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો.

A) યમક
B) અનન્વય
C) ઉત્પ્રેક્ષા
D) ઉપમા

248. સમાસ ઓળખાવો : મહાવીર

A) દ્વિગુ
B) કર્મધારય
C) દ્વન્દ્વ
D) ઉપપદ

249. કવિ અખાનો મૂળ વ્યવસાય ક્યો હતો.

A) દરજી
B) સોની
C) લુહાર
D) સુથાર

250. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રૂપિયા ભરવાની સાંકડી લાંબી કોથળી.

A) વાંગળી
B) વાંસોડ
C) વાંસલો
D) વાંસળી

251. સમાનાર્થી શબ્દ લખો : રિપુ

A) મિત્ર
B) અરિ
C) રાક્ષસ
D) સીધું

252. છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો !

A) શાર્દૂલવિક્રીડિત
B) શિખરિણી
C) મંદાક્રાન્તા
D) સગ્ધરા

253. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે?

A) ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી
B) ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર
C) ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી
D) ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા

254. અસીમ રાંદેરીનું નામ શું છે?

A) મહમુદમિયાં મહમદ ઈમામ
B) સૈયદ અમીર હસન
C) સૈયદ અબ્દુલ વહીદ
D) અલીખાન ઉસમાનખાન બલૂચ

255. અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે.

A) ઉપમા
B) રૂપક
C) શ્લેષ
D) વર્ણાનુપ્રાસ

256. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક

A) માસિક
B) સાપ્તાહિક
C) પાક્ષિક
D) દૈનિક

---

247)C, 248)B, 249)B, 250)D, 251)B, 252)D, 253)A, 254)A, 255)D, 256)C.

257. છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.

A) અનુષ્ટુપ
B) મંદાક્રાન્તા
C) પૃથ્વી
D) હરિગીત

258. 'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો.

A) વાડને ટેટી - તરબૂચ ભાવે.
B) વાડ જ ચીભડાં ખાઈ જાય.
C) રક્ષક જ ભક્ષક બને.
D) વાડ વગર વેલો ના ચડે.

259. સંધિ લખો : ઉચ્ચાલન

A) ઉચ્ચ + અલન
B) ઉદ્ + ચલન
C) ઉદ્ + ચાલન
D) ઉચ્ચ + અલન

260. નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ?

A) અપરાધી
B) વેવિશાળ
C) સ્મૃતિગાન
D) તુલસીક્યારો

261. એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે?

A) વિરુદ્ધાર્થી
B) પ્રશ્નવાચક
C) પર્યાયવાચી
D) આધિત પદ

262. રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો.

A) કોઠી સાફ કરવી.
B) કામમાં સફળતા મળવી.
C) ચોટેલો કાદવ કાઢવો.
D) નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી.

263. વિરોધી શબ્દ લખો : પ્રત્યક્ષ

A) પરોક્ષ
B) નિરપેક્ષ
C) સાપેક્ષ
D) અક્ષ

264. 'દાબડો' શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ?

A) ડબ્બો
B) ડાભ
C) દાબણીયું
D) દર્ભ

265. 'ફાફડા' શબ્દનો ક્યો ગણ થશે ?

A) ય - ગણ
B) ર - ગણ
C) મ - ગણ
D) ન - ગણ

257)B, 258)C, 259)C, 260)C, 261)C, 262)D, 263)A, 264)A, 265)B.

266. નીચે આપેલી કહેવતનો સાચો અર્થ લખો :
'કૂવામાં હોય તો હવાડામાં આવે.'
A) મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાઈ આવે જ.
B) કૂવો ખાલી હોય પણ હવાડો ભરેલો રહે છે.
C) કૂવામાં પાણી ના હોય તો અવાડામાં આવે.
D) શિક્ષક કરતાં વિદ્યાર્થી હોશિયાર હોય છે.

267. 'સોસાયટી, યુનિવર્સિટી, આઈસક્રીમ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ?
A) ગુજરાતી B) અંગ્રેજી
C) સંસ્કૃત D) ફ્રેન્ચ

268. નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ?
A) ખેતર, નોટ, પ્રેત, સોનું B) આંક, માનવી, નોટ, ખેતર
C) ખેતર, પ્રેત, આંક, માનવી D) આંક, ખેતર, સોનું, પ્રેત

269. 'અભિમાની' શબ્દનો સાચો વિરોધી શબ્દ શોધો.
A) પ્રમાણિક B) નિરાભિમાની
C) નિરભિમાની D) પ્રામાણિક

270. સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધીને લખો.
A) જ્યોતિષી B) અવિનાસ
C) હરીવર D) તિર્થોત્તમ

271. 'પાટે ચઢી જવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
A) ભૂલ સુધારવી B) પુષ્ટિ મળવી
C) સાચો રસ્તો જડવો D) કામધંધે ચઢી જવું

272. નીચેનામાંથી ક્યા ક્ષેત્ર માટે 'જ્ઞાનપીઠ' પુરસ્કાર આપવામાં આવે છે ?
A) સાહિત્ય B) રાજનીતિ
C) આરોગ્ય D) સમાજસેવા

273. સાચી સંધિ જોડેલો શબ્દ શોધી કાઢો.
A) સ્વ + અચ્છ = સ્વચ્છ B) શિર્ + મણિ = શિરોમણિ
C) મહે + ઈચ્છા = મહેચ્છા D) સ્વ + ઈચ્છા = સ્વેચ્છા

274. 'લોહીની સગાઈ' ક્યા પ્રકારની રચના છે ?
A) નવલિકા B) નાટક
C) નવલકથા D) કાવ્ય

---

266)A, 267)B, 268)A, 269)B, 270)A, 271)D, 272)A, 273)D, 274)A.

275. સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો.
A) કૂંજલડી
B) પ્રિતી
C) સુરભિસુત
D) ભિતિ

276. 'ભીત ભૂલવી' રૂઢિપ્રયોગ માટે ક્યો અર્થ યોગ્ય નથી ?
A) અવળે રસ્તે ચડી જવું
B) સાચો રસ્તો ભૂલવો
C) માર્ગ ચૂકવો
D) ઘરની દીવાલ યાદ ન રહેવી

277. 'મીનુને મારી ગાળો ગોળથીયે મીઠી લાગતી' - અલંકાર ઓળખાવો.
A) ઉત્પ્રેક્ષા
B) ઉપમા
C) વ્યતિરેક
D) શ્લેષ

278. સાચી સંધિ જોડેલો શબ્દ શોધો.
A) હિત + એષી = હિતેષી
B) હર્ષ + ઉલ્લાસ = હર્ષુલ્લાસ
C) હસ્તા + અક્ષર = હસ્તાક્ષર
D) હર્ષ + આવેશ = હર્ષાવેશ

279. 'કુંવરબાઈનું મામેરું'ના કવિ કોણ છે?
A) નરસિંહ મહેતા
B) ગંગાસતી
C) મીરાંબાઈ
D) પ્રેમાનંદ

280. સમાસ ઓળખાવો : 'ગૃહસ્થ'
A) કર્મધારય
B) ઉપપદ
C) તત્પુરુષ
D) દ્વન્દ્વ

281. અ + અ = આ - સંધિ માટે ક્યો શબ્દ સાચો છે ?
A) વૃદ્ધાવસ્થા
B) ભાષાન્તર
C) શિષ્ટાચાર
D) વિશ્વાધાર

282. 'જિજ્ઞાસુની ડાયરી' પુસ્તક કોનું છે ?
A) પીરો ભગત
B) પુરુરાજ જોશી
C) મણિશંકર ભટ્ટ
D) મણિલાલ હ. પટેલ

283. 'દુહિતા' શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે?
A) દીકરી
B) પૌત્રી
C) વહુ
D) દોહિત્રી

284. નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ?
A) પ્રતિઘોષ
B) પ્રતિધ્વનિ
C) પડઘો
D) ધ્વનિ

275)C, 276)D, 277)C, 278)D, 279)A, 280)B, 281)A, 282)B, 283)A, 284)D.

285. 'બેચેની ભરી શાંતિ' માટે કયો શબ્દસમૂહ યોગ્ય છે ?

A) વિરક્ત B) અગોચર

C) સન્નાટો D) અચંબો

286. શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો.

A) કા, ખુ, ઘુ, ભૈ B) ક, ટ, ત, ચ

C) ક, ર, મ, ત D) ડ, ટી, ઠો, ઢા

287. નીચે પૈકી ક્યા તખલ્લુસવાળા લેખકનો સમાવેશ હાસ્ય લેખકમાં કરી શકાય ?

A) સુંદરમ્ B) અવળવાણિયા

C) દર્શક D) સારસ્વત

288. બે વાક્યને જોડવા માટે શું પ્રયોજાય છે ?

A) સંયોજક B) વિભક્તિ

C) અનુગ D) નામયોગી

289. નીચેનામાંથી ક્યો સમાસ 'તત્પુરુષ છે ?

A) મરણશરણ B) પરશામ

C) શાંતિકર D) ટપાલપેટી

290. ક્યું જોડકું વિરોધી શબ્દ માટે યોગ્ય છે ?

A) હરખ x હડફ B) મજમ x સહિયારું

C) પવનપંથો x પાણીપંથો D) જંગમ x સ્થાવર

291. કવિ કાન્તે રચેલી 'રોમન સ્વરાજ' કૃતિનું સ્વરૂપ જણાવો.

A) ખંડકાવ્ય B) નાટક

C) ઈતિહાસ D) નવલકથા

292. 'શિખરિણી' છંદનું ઉદાહરણ શોધો.

A) નાગરવેલના જેવી નાજુકડી નાર વાંકી.

B) વેશ ટેક છે આડી ગલી, પેઠો તે નવ શકે નીકળી.

C) છતાંય દિલ તો ચાહે તન યુવાનની તાજગી.

D) કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો.

293. 'સૂડા બહોતેરી' કોની રચના છે ?

A) શામળ B) ધીરો

C) અખો D) પ્રેમાનંદ

---

285)C, 286)A, 287)B, 288)A, 289)A, 290)D, 291)B, 292)D, 293)A.

294. સંપનું મહત્ત્વ દર્શાવતી કહેવત કઈ નથી ?

A) ઝાડ ટકે છે ઝૂંડમાં
B) ઝાઝા હાથ રળિયામણા
C) ઝાઝી કીડીઓ સાપને તાણે
D) ઝાઝા મળે ને ખાવા ટળે

295. વિરોધી શબ્દ દર્શાવતું સાચું જોડકું શોધો.

A) ઉણપ x ખામી
B) કુટુંબ x કબીલો
C) યૌવન x વૃદ્ધત્વ
D) રસ્તો x વાટ

296. કવિ નર્મદને 'વીર નર્મદ'નું બિરુદ કેમ મળ્યું છે ?

A) મુંબઈની શાળામાં શિક્ષક બન્યા તેથી.
B) સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો તેથી.
C) રૂઢિવાદ સામે ઝઝૂમવાની આગેવાની લીધી તેથી.
D) સ્ત્રી કેળવણીના લાભ દર્શાવ્યા તેથી.

297. 'મારું આખું શરીર મલ્લની જેમ મસળવા માંડ્યું.' - અલંકાર શોધો.

A) શબ્દાનુપ્રાસ
B) વર્ણાનુપ્રાસ
C) યમક
D) પ્રાસ સાંકળી

298. 'પૈસાના ઝાડ હોવા' - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) ખૂબ મહેનત પડવી
B) પુષ્કળ ધન હોવું
C) રોમાંચિત થઈ ઊઠવું
D) ઝાડ પર પૈસા ઊગવા

299. હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે?

A) 24
B) 28
C) 15
D) 32

300. સંધિ જોડો.

પૌ + અન

A) પવન
B) પાવન
C) પાવક
D) પૌઅન

301. કવિશ્રી ઝવેરચંદ મેઘાણી નીચેનામાંથી ક્યા સમાચારપત્ર સાથે સંકળાયેલ નહોતા ?

A) સવાર
B) ફૂલછાબ
C) સૌરાષ્ટ્ર
D) જન્મભૂમિ

302. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ છોડો.

પ્રત્યુતર

A) પ્રતયુ + ઉત્તર
B) પ્રતયુ + ત્તર
C) પ્રતિ + ઉત્તર
D) પ્રતિ + યુત્તર

294)D, 295)C, 296)C, 297)B, 298)B, 299)B, 300)B, 301)A, 302)C.

303. નીચે આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
જયણા -
A) પારણા
B) સંસ્કાર
C) જતન
D) એકાસણા

304. 'ઐશ્વર્ય' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
A) સુંદર
B) દારિદ્રય
C) ઐશ્વર્યાશય
D) ગરીબાઈ

305. 'કવિ શિરોમણી' તરીકે માન મેળવનાર કવિશ્રી પ્રેમાનંદ ક્યાંના વતની હતા ?
A) ચાણોદ
B) મેવાડ
C) વડોદરા
D) રાજકોટ

306. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
જમાલ -
A) વાક્છટા
B) સૌંદર્ય
C) વાણી-વિલાસ
D) શૌર્યવાન

307. 'બહાર મેળો લાગેલો હતો.'
લાગેલો - કૃદંતનો પ્રકાર જણાવો.
A) વર્તમાનકૃદંત
B) ભૂતકૃદંત
C) ભવિષ્યકૃદંત
D) સંબંધક ભૂતકૃદંત

308. કવિ બોટાદકરનું ક્યું કાવ્ય માના વાત્સલ્યભાવને રજૂ કરે છે ?
A) જ્યોતિધામ
B) બાની ચીમટી
C) જનની
D) નમાવી બા આવી

309. 'ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) કલ્પવૃક્ષ
B) બોધિવૃક્ષ
C) શીમળાનું વૃક્ષ
D) અશ્વત્થામા વૃક્ષ

310. પતિ મરી ગયો હોય તો <u>વિધવા</u> - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો.
A) દ્વન્દ્વ
B) તત્પુરુષ
C) બહુવ્રીહિ
D) ઉપપદ

311. 'નિરવાસીત' શબ્દની સાચી જોડણી લખો.
A) નીર્વાસીત
B) નીરવસિત
C) નિર્વાસિત
D) નિર્વાસીત

303)C, 304)B, 305)C, 306)B, 307)B, 308)C, 309)A, 310)C, 311)C.

312. 'પુણ્ય પરવાર્યું નથી' અને 'હરિનો મારગ' સત્યકથાઓ લખનાર લેખક કોણ છે ?

A) ન્હાનાલાલ
B) પ્રેમાનંદ
C) ગુલાબદાસ બ્રોકર
D) રાજેન્દ્ર શાહ

313. થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં ક્યો અલંકાર દર્શાવાયો છે ?

A) સજીવારોપણ
B) શ્લેષ
C) ઉત્પ્રેક્ષા
D) વ્યતિરેક

314. નીચેનામાંથી ક્યું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો.

A) વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન !
B) ગોપીઉને વા'લો કાનુડો
C) લાવ તો ચકુ મને જોવા દે તો ખરી !
D) આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે

315. 'ઉત્તમ ઊર્મિ કવિ' અને 'ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક' તરીકે ખ્યાતિ પામેલા કવિ કોણ હતા?

A) દયારામ
B) નરસિંહ મહેતા
C) પ્રેમાનંદ
D) કવિશ્રી ન્હાનાલાલ

316. 'ઈચ્છા કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

A) ઈચ્છુક
B) સ્પૃહા
C) સરાહનીય
D) સ્પૃહણીય

317. કડકડાટ બોલવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

A) અટકી-અટકીને બોલવું
B) મોટેથી બોલવું
C) સતત બોલવું
D) અટક્યા વગર બોલવું

318. વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો.

A) પૂર્વજ-અનુજ
B) શુભ્ર- નિર્મળ
C) ઉદ્યમી- પ્રમાદી
D) વીજળી-દામિની

319. તળપદા શિષ્ટ શબ્દોનું ક્યું જોડકું ખોટું છે ?

A) હરવર-હલચલ
B) સરસાઈ-ચઢિયાતાપણું
C) આણીપા-આ બાજુ
D) છાક – નશો

320. 'કરાલ' શબ્દનો સામાનાર્થી જણાવો.

A) ઘેરી
B) ઘોર
C) ગાઢ
D) ભયંકર

---

312)C, 313)B, 314)B, 315)D, 316)D, 317)D, 318)C, 319)A, 320)D.

321. બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) ભોગર
B) ભોગળ
C) કમાન
D) દંડો

322. ભૂખ્યાજનો અને ગરીબોને સદાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
A) દાન
B) દક્ષિણા
C) સહાય
D) સદાવ્રત

323. સાચી જોડણી શોધો.
A) પ્રોષિતભરતૃકા
B) પ્રોશિભતૃકા
C) પ્રોષિતભતૃકા
D) પ્રોષીતભતૃકા

324. નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. : નિશા
A) નિશા
B) યામિની
C) દામિની
D) તટિની

325. વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો.
A) વિનોદ - હાસ્ય
B) હર્ષ - ખુશી
C) હર્ષ-શોક
D) આનંદિત-પુલકિત

326. ડૂબી જઈને ઘન અંધારે, શીતે ધ્રુજી સૃષ્ટિ સમસ્ત ત્યારે - ઉપરની પંક્તિ ક્યા છંદમાં છે ?
A) ઉપેન્દ્ર વ્રજા
B) ઈન્દ્ર વ્રજા
C) ઉપજાતિ
D) મંદાક્રાન્તા

327. વસંત માંહી કળિ માધવીની, કલા શશીની શરદે નવીની - આ પંક્તિઓ ક્યા છંદમાં છે ?
A) ઉપેન્દ્ર વ્રજા
B) ઈન્દ્ર વ્રજા
C) ઉપજાતિ
D) મંદાક્રાન્તા

328. આ મૃત્યુ ! આ પ્રણયને રસ એકતા આ !
આ મધ્યબિંદુ સહુ જાળનિ ગૂંથણી નૂ ! - આ પંક્તિઓ ક્યા છંદમાં રચાયેલી છે ?
A) ઈન્દ્ર વ્રજા
B) ઉપજાતિ
C) હરીગીત
D) વસંતતિલકા

329. ભૂતળના લોકે અમે ઈન્દ્રભુવનમાં, જને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે. - આ પંક્તિ ક્યા છંદમાં છે ?
A) મંદાક્રાન્તા
B) ઉપજાતિ
C) મનહર
D) ઈન્દ્ર વ્રજા

330. અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ, એક તો લઈ જુઓ જરીક શ્વાસ !
- ઉપરની પંક્તિ ક્યા છંદમાં રચાઈ છે ?
A) ગુલબંકી
B) મનહર
C) કટાવ
D) ઈન્દ્ર વ્રજા

---

321)B, 322)D, 323)C, 324)B, 325)C, 326)B, 327)A, 328)D, 329)C, 330)A.

331. નીચેની કઈ સંધિ સાચી છે ?
A) પરમ + ઈશ્વર
B) પરમી + શ્વર
C) પર્માં + શ્વર
D) પ્રમી + ઈશ્વર
332. નયનની સંધિ નીચે મુજબ સાચી પાડી છે તે કઈ સાચી છે ?
A) નય + ન
B) ન + યન
C) ન + અન
D) ને + અન
333. ઈત્યાદીની સંધિ છૂટી પાડો.
A) ઈત્ય + આદિ
B) ઈતિ + આદિ
C) ઈત + આદિ
D) ઈત્યા + આદિ
334. ઉચ્છેદની સંધિ નીચે મુજબ સાચી છે
A) ઉચ્ + છેદ
B) ઉચ્છે + દ
C) ઉન્ + છેદ
D) ઉત્ + છેદ
335. 'હવાપાણી' શબ્દ ક્યો સમાસ દર્શાવે છે ?
A) મધ્યમપદલોપી
B) તત્પુરૂષ
C) દ્વન્દ્વ
D) અવ્યવીભાવ
336. 'સંસાર દર્શન' ક્યો તત્પુરૂષ સમાસ છે ?
A) દ્વિતિયા તત્પુરૂષ
B) પંચમી તત્પુરૂષ
C) સપ્તમી તત્પુરૂષ
D) ષષ્ઠી તત્પુરૂષ
337. 'વરાળ યંત્ર' ક્યા સમાસનું ઉદાહરણ છે ?
A) મધ્યમપદ લોપી સમાસ
B) કર્મધારય સમાસ
C) બહુવ્રીહિ સમાસ
D) તત્પુરૂષ સમાસ
338. 'આજન્મ' શબ્દ ક્યો સમાસ દર્શાવે છે ?
A) કર્મધારય સમાસ
B) અવ્યવીભાવ સમાસ
C) દ્વિગુ સમાસ
D) દ્વન્દ્વ સમાસ
339. 'સદાચાર' ક્યા સમાસનું ઉદાહરણ છે ?
A) દ્વિગુ સમાસ
B) બહુવ્રીહિ સમાસ
C) કર્મધારય સમાસ
D) દ્વન્દ્વ સમાસ
340. કામિની કોકિલા કેલિ કૂંજન કરે - આ પંક્તિમાં ક્યો અલંકાર છે ?
A) અંત્યાનુપ્રાસ અલંકાર
B) વર્ણાનુપ્રાસ અલંકાર
C) ઉપમા અલંકાર
D) રૂપક અલંકાર

331)A, 332)D, 333)B, 334)D, 335)C, 336)D, 337)A, 338)B, 339)C, 340)B.

341. કેતકીના સોટાનીજેમ રજપૂતાણી ટટ્ટાર થઈ. - ઉપરના વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ?
A) અંત્યાનુપ્રાસ અલંકાર
B) રૂપક અલંકાર
C) ઉપમા અલંકાર
D) શ્લેષ અલંકાર

342. ગંગાના નીર વધે ઘટે રે લોલ, સરીખો એ પ્રેમનો પ્રવાહ જો - આ પંક્તિમાં ક્યો અલંકાર પ્રયોજાયો છે ?
A) અનન્વય અલંકાર
B) શ્લેષ અલંકાર
C) વ્યાજસ્તુતિ અલંકાર
D) વ્યતિરેક અલંકાર

343. તમે ખરા બહાદુર ! ઉંદરથી પણ બીઓ ! - અહીં ક્યો અલંકાર વપરાયો છે ?
A) સજીવારોપણ અલંકાર
B) વ્યાજસ્તુતિ અલંકાર
C) શ્લેષ અલંકાર
D) ઉત્પ્રેક્ષા અલંકાર

344. 'જવાની તો જવાની' - અહીં ક્યો અલંકાર યોજાયો છે ?
A) વ્યાજસ્તુતિ અલંકાર
B) સજીવારોપણ અલંકાર
C) વ્યતિરેક અલંકાર
D) શ્લેષ અલંકાર

345. વિરુદ્ધાર્થી શબ્દોમાં નીચે ક્યું જોડકું ખોટું છે ?
A) અગ્રજ-સમગ્ર
B) અખંડ-ખંડિત
C) અતડું-મિલનસાર
D) અજ્ઞ-સુજ્ઞ

346. નીચેનામાંથી ક્યો વિરુદ્ધાર્થી શબ્દો સાચો છે ?
A) અનુગામી-અગ્રજ
B) અભિમાની-ગરીબ
C) આસુરી-દૈવી
D) અલ્પોક્તિ- સુક્તિ

347. નીચેનામાંથી ક્યા વિરુદ્ધાર્થી શબ્દો ખોટા છે ?
A) ઈષ્ટ-અનિષ્ટ
B) ઉત્થાન-પતન
C) ઉદય-અસ્ત
D) આધ્યાત્મિક-ઉદાસિન

348. નીચેનામાંથી ક્યો વિરુદ્ધાર્થી શબ્દનું જોડકું સાચુ છે ?
A) ઉખર-ફળદ્રુપ
B) ઉતાવળ-પતન
C) ઉદાસ-પસ્ત
D) ઉધાર-ઉખર

349. નીચેનામાંથી ક્યો શબ્દ 'વેરાન'નો સમાનાર્થી નથી ?
A) એકાંત
B) સહરા
C) જનશૂન્ય
D) તાલેવંત

---

341)C, 342)D, 343)B, 344)D, 345)A, 346)C, 347)D, 348)A, 349)D.

350. નીચેનામાંથી ક્યો શબ્દ 'કાવ્ય'નો સમાનાર્થી છે ?

A) કવન
B) ઈતિહાસ
C) આગાહી
D) અધ્યાય

351. નીચેનામાંથી ક્યો શબ્દ 'વરસાદ'નો પર્યાય છે ?

A) કમલિની
B) ટૂંડી
C) ઝડી
D) વાપી

352. 'ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન' કહેવતનો અર્થ શું છે ?

A) ઉજ્જડ વેરાનમાં એરંડો ઊગે
B) જ્યાં કોઈ લાયક વ્યક્તિ ન હોય તેવા સ્થળે ઓછી લાયકાતવાળાનું મહત્વ વધે
C) એરંડો આપણો મુખ્ય પાક છે
D) ગામમાં ફક્ત એરંડો જ ઊગી શકે

353. 'આંખને પોપચાનો ભાર ન લાગે' તે કહેવતનો અર્થ શું થાય ?

A) આંખથી પોપચા જોઈ ન શકાય
B) આંખ અને પોપચા એક જ છે
C) આંખ પોપચા નીચે આવી છે તેથી તેનું વજન ન લાગે
D) પોતાનાનો કોઈ બોજ ન વરતાય

354. 'કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી' કહેવતનો ભાવાર્થ

A) કંસાર કરવા જતા અનાયાસે થૂલી થઈ ગઈ
B) કંસારા બજારમાં જઈને થૂલી લઈ આવ્યા
C) કંસારાઓ સારી થૂલી બનાવી શકે છે
D) ઈચ્છેલું પરિણામ ન મળ્યુ

355. 'માથુ મારવુ' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

A) બિનજરૂરી ડખલ કરવી તે
B) આખલો શિંગડું મારે તે
C) કોઈને ઈજા કરવી તે
D) કોઈની છાતીમાં માથુ અથડાવવું

356. 'માથામાં પવન ભરાવો' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

A) શરદી થવી
B) માથા પર પવન લાગવો
C) બિનજરૂરી મિજાજ બતાવવો
D) માથાની અંદર હવા જવી

350)A, 351)C, 352)B, 353)D, 354)D, 355)A, 356)C.

357. 'મોં-માથુ સુઝવુ નહી' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

A) મો દેખાય પણ માથું ન દેખાય
B) સમજણ ન પડવી
C) અંધારામાં કશું ન દેખાવું
D) મોં અને માથુ ચડી જવું

358. 'માથે છાણા થાપવાં' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

A) ટીકાઓ કરવી
B) છાપરા પર છાણાં થાપવા
C) માથા પર ધૂળ નાખવી
D) ભીંતે છાણા થાપવા

359. 'મીઠા ઝાડના મૂળ કાપવા' રૂઢિપ્રયોગનો અર્થ શુ થાય ?

A) મીઠા લીંબડાના મૂળ કાપીને સરખા કરવા
B) કોઈનો અણછાજતો લાભ લેવો
C) તક ગુમાવવી
D) નાખુશ થવું

360. 'ટચલી આંગળી પાસેની આંગળી' શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

A) અનામિકા
B) તર્જની
C) મધ્યમા
D) અંગુષ્ઠ

361. 'જીવાત્મા અને પરમાત્મા એક જ છે'- એવા શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

A) દ્વૈતવાદ
B) એકાંતવાદ
C) અદ્વૈતવાદ
D) ઉદાસીવાદ

362. 'પોતાની જાત ઉપર આધાર રાખનાર' શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

A) આપદધર્મી
B) આપકર્મી
C) આપદાકર
D) આત્મસંયમી

363. 'આકાશમાં ફરનારું' શબ્દસમૂહ માટે એક શબ્દ કયો છે ?

A) ભૂચર
B) જળચર
C) અચળ
D) ખેચર

364. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

A) આજ્ઞાંકીત
B) આજ્ઞાંકિત
C) આગ્નાંકિત
D) આધાંકિત

365. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

A) ઊબકો
B) ઉબકો
C) ઉપકો
D) યુબકો

366. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?

A) બ્રમચર્ય
B) બ્રહ્મચર્ય
C) બ્રાહ્મચર્ય
D) બ્રમચર

357)B, 358)A, 359)B, 360)A, 361)C, 362)B, 363)D, 364)B, 365)A, 366)B.

367. નીચેનામાંથી બન્ને જોડણી સાચી છે અને બન્નેનો અર્થ એકજ થાય છે.

A) ભલાઈ-ભલાય
B) મુકદમો-મુકાદમ
C) મેશ-મેચ
D) ભેંસ-ભેંશ

368. નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

A) ''રૂપે અરુણ ઉદય સરખો''
B) ''કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી''
C) ''ગુલછડી સમોવડી તે બાલિકા હતી''
D) '' મા તે મા, બીજા બધા વનવગડાના વા''

369. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.

અશ્વ -

A) તોખાર
B) ગદર્ભ
C) ખજ
D) અજ

370. કઈ જોડી ખોટી છે તે શોધો.

A) કસ્તૂરી-સ્ત્રીલિંગ
B) પૂંજી-પુલ્લિંગ
C) વસાણું-નપુંસકલિંગ
D) ઓવરો-પુલ્લિંગ

371. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.

સરસ્વતી -

A) સુંદર
B) સુરત
C) ભારતી
D) ભરતી

372. લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે?

A) ગોળો-ગોળી
B) પલંગ-ખુરશી
C) પર્વત-દીવાલ
D) બાળક-છોકરું

373. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.

ફૂવડ

A) ગંદકી
B) સ્વસ્થ
C) સુઘડ
D) બેડોળ

374. નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.

ઊખર -

A) ઊંડું
B) છીછરુ
C) પતન
D) ફળદ્રુપ

367)D, 368)D, 369)A, 370)B, 371)C, 372)D, 373)C, 374)D.

375. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.
A) મૂશળધાર B) સાંબેલાધાર
C) સરવડું D) ટપકટપક પડવું

376. આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે.
(લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)
A) મરુભૂમિ B) ખૂંપણ
C) કાંપાળ જમીન D) ચિકણી જમીન

377. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.
A) દ્વન્દ્વ B) તત્પુરુષ
C) બહુવ્રીહિ D) અવ્યયી ભાવ

378. સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો.
A) વાસ - સાથ B) કપટી - ઠગારું
C) ચૂવું - ટપકવું D) લાડણી - વહાલી

379. 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો.
A) અભિમાનમાં ખરાબ દેખાવ કરે B) ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
C) સારા ખરાબનો કદી વિચાર ન કરે D) કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

380. 'પુત્રૈષણા'ની સંધિ છૂટી પાડો.
A) પુત્ર + ઐષણા B) પુત્ર + એષણા
C) પુત્રે + ષણા D) પુત્રૈ + ષણા

381. નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.
A) લુચ્ચું - લુચ્ચાઈ B) દવા - દવાઈ
C) મધુર - માધુર્ય D) કુશળ - કુશળતા

382. નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.
પ્રતિ + એક
A) પ્રતિએક B) પ્રતયેક
C) પ્રત્યેક D) પતાકા

375)C, 376)A, 377)A, 378)A, 379)B, 380)B, 381)B, 382)C.

383. ક્યું લિંગપરિવર્તન સાચું નથી ?

A) ધૂળ – ધૂળિયું

B) ગધેડા - ગધેડી

C) જીભડી - જીભડો

D) મૂંગો – મૂંગી

384. 'ખીલો થઈ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

A) ઊભા રહી જવું

B) જડ થઈ જવું

C) ભીંતમાં ખીલો જડી દેવો

D) અંદર જતા રહેવું

385. સાચી જોડણી શોધો.

A) જીજ્ઞાસા

B) જિજ્ઞાષા

C) જિજ્ઞાસા

D) જીગ્નાશા

386. મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત <u>તીર્થોત્તમ</u> મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.

A) દ્વન્દ્વ

B) મધ્યમપદ લોપી

C) કર્મધારય

D) ઉપપદ

387. નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

A) ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર

B) નવી નવી ઈચ્છાઓ થવી-ઉંકરાટા

C) દુ:ખનો પોકાર-આર્તનાદ

D) હું પણાનો ભાર-સ્વાભિમાન

388. નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું ક્યું ઉદાહરણ નથી ?

A) અધમૂઓ

B) ભજન મંડળી

C) સિંહાસન

D) રેવાશંકર

389. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

A) જ સ જ સ ય લ ગા

B) ય મ ન સ ભ લ ગા

C) મ સ જ સ ત ત ગા

D) મ ર ભ ન ય ય ય

390. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી ?

A) હોલ

B) આંગણું

C) સ્ટોરરૂમ

D) ગજાર

391. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?

A) અતિરીક્ત

B) અદ્દભૂત

C) દિક્ષીત

D) મોંસૂઝણું

383)A, 384)A, 385)C, 386)C, 387)D, 388)A, 389)C, 390)D, 391)D.

392. 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે?

A) મંદાક્રાંતા
B) પૃથ્વી
C) હરિગીત
D) હરિણી

393. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ -

A) શ્વેત
B) વેદ
C) શ્રમ
D) વિલાસી

394. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ

A) હેતુ + આભાસ
B) હેત્ + આભાસ
C) હેતવ + આભાસ
D) હેત્વ + ભાસ

395. 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

A) અનન્વય
B) સજીવારોપણ
C) ઉપમાં
D) ઉત્પ્રેક્ષા

396. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.

મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

A) દ્વિતીયા તત્પુરુષ
B) પ્રથમા તત્પુરુષ
C) તૃતીયા તત્પુરુષ
D) ચતુર્થી તત્પુરુષ

397. નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.

હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.

A) હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.

B) હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.

C) હરિયો બસમાં બેઠો. એક માણસ જોઈએ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.

D) હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.

---

392)A, 393)B, 394)A, 395)D, 396)C, 397)D.

398. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
પડી વજાડવો -
A) ઢોલ વગાડવો
B) જાણ કરવી
C) ખબર પડવી
D) જાહેરાત કરવી

399. 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો.
A) આપણે
B) છીએ
C) પણ
D) સર્વત્ર

400. 'મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો' કર્મણિ વાક્યમાં લખો.
A) ગાડીના અવાજને મનોજે સાંભળ્યો
B) ગાડીથી મનોજને અવાજ કરાયો
C) મનોજને ગાડીના અવાજથી સંભળાયુ
D) મનોજથી ગાડીનો અવાજ સંભળાયો

401. 'પાણીપંથા' માટે કઈ વાત સાચી છે ?
A) પાણીમાં રસ્તો બનાવનાર
B) પૂરના પાણીની ઝડપે દોડનાર
C) પાણીમાં પંથ બતાવી દોડનાર
D) પંખીની પાંખેને પાણીના પ્રવાહે જવું

402. આપેલા વાક્યોમાંથી સાચું વાક્ય શોધો.
A) બંધા બાળકને લાડું આપવામાં આવશે
B) બંધા બાળકને લાડુઓ આપવામાં આવશે
C) દરેક બાળકને લાડુ આપવામાં આવશે
D) દરેક બાળકોને લાડું આપવામાં આવશે

403. સમાનાર્થી શબ્દો શોધો : પીયૂષ
A) સુધા
B) પરમતત્વ
C) સ્પૃહનીય
D) પ્રિય

404. 'દોઢ ડાહ્યુ' સમાસનો પ્રકાર જણાવો.
A) દ્વન્દ્વ
B) ઉપપદ
C) તત્પુરૂષ
D) દ્વિગુ

405. 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન ક્યા શબ્દ પછી આવશે.
A) મહારાજ
B) વાયદો
C) બેફિકર
D) રહો

398)D, 399)C, 400)D, 401)C, 402)D, 403)A, 404)D, 405)D.

406. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ

A) ધોડાર
B) વાંસણી
C) કુંજાર
D) જોગાણ

407. જોડણીની દૃષ્ટિએ સાચો શબ્દ છે

A) સ્તુતિ
B) સ્તુતી
C) સ્તુતિ
D) સ્તૂતી

408. ભાષાંતરનો અર્થ છે.

A) તરકારી
B) તરજુમો
C) તરકીબ
D) તરવટ

409. 'દુષણ'નો વિરુદ્ધાર્થી શબ્દ ક્યો છે ?

A) આભૂષણ
B) કદૂષણ
C) ભૂષણ
D) પ્રદૂષણ

410. નીચેના વાક્યમં ક્યું એક સર્વનામ નથી.
'તુ તેને કહી દેજે કે તેનો આમા ભાગ નથી'

A) તેને
B) તેનો
C) આમા
D) તું

411. 'ભોજા ભગતની' રચનાઓ ક્યા પ્રકારે ઓળખાય છે ?

A) આખ્યાન
B) ભજન
C) ચાબખા
D) છપ્પા

412. 'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નિપાત ઓળખાવો.

A) ત્યાં
B) જ
C) સુધી
D) જ્યાં

413. 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો.

A) જમણા
B) પગે
C) જોરથી
D) ક્રૂર

414. 'ગંગાધર' સમાસનો પ્રકાર ક્યો ?

A) તત્પુરૂષ
B) કર્મધારય
C) ઉપપદ
D) બહુવ્રીહિ

---

406)D, 407)A, 408)B, 409)C, 410)C, 411)C, 412)B, 413)C, 414)C.

415. છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી'

A) મિશ્રોપજાતિ
B) વસંતતિલકા
C) માલિની
D) હરિણી

416. છંદ ઓળખાવો : 'કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે'

A) પૃથ્વી
B) મંદાક્રાંતા
C) હરિણી
D) શિખરીણી

417. રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં

A) ભાન કરાવવું
B) બહુ જ તોફાની હોવું
C) મુરખના સરદાર હોવું
D) આનાકાની કરવી

418. નીચેના વાક્યમાં ક્યો શબ્દ સંજ્ઞા છે ?

'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું'

A) મારે
B) જાણીતા
C) સજ્જન
D) એક

419. મારા કંઠ માટે શરદી........પક્ષપાત છે.

ઉપરોક્ત ખાલી જગ્યામાં ક્યો પ્રત્યય આવશે ?

A) નું
B) ના
C) ને
D) નો

420. જોડાક્ષરની કઈ એક જોડ સાચી છે?

A) ક્ + સ = ક્ષ
B) ક્ +શ્ = ક્ષ
C) ક્ + ક્ષ = ક્ષ
D) ક્ + ષ્ = ક્ષ

421. 'નિશીથ' શબ્દનો અર્થ આપો.

A) મધ્યાહન
B) સાયંકાળ
C) મધ્યરાત્રિ
D) પ્રાતઃ કાળ

422. જોગીની ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. આ વાક્યમાં વપરાયેલા અલંકારનો પ્રકાર જણાવો.

A) રૂપક
B) ઉત્પ્રેક્ષા
C) સમન્વય
D) ઉપમા

---

415)B, 416)A, 417)B, 418)C, 419)D, 420)D, 421)C, 422)D.

423. 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો.

A) ઉંચા
B) ઉપર
C) બેઠો છે
D) ભયંકર

424. 'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.

A) હેત્વર્થ કૃદંત
B) ભવિષ્ય કૃદંત
C) વર્તમાન કૃદંત
D) સંબંધક કૃદંત

425. ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતાં. લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.

A) સમકાલીન
B) સામાજિક
C) સંમોવડિયા
D) સમકાલિક

426. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
જેમ્સ વોટે વરાળયંત્રની શોધ કરી હતી.

A) મધ્યમપદલોપી સમાસ
B) કર્મધારય સમાસ
C) ઉપમિત સમાસ
D) દ્વિગુ સમાસ

427. ઊંટના અઢારે વાંકા-કહેવતનો અર્થ કયો છે ?

A) દોષનો ભંડાર
B) દુર્જન સાથે કામ કરવાથી કલંક લાગે
C) કામ કરનારને આ પ્રિય લાગે
D) બાહ્ય દેખાવથી છેતરાવું નહી

428. સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ?

A) દ્વિગુ
B) તત્પુરુષ
C) ઉપપદ
D) મધ્યમપદલોપી

429. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.
કાનન

A) વન
B) કૂમળું
C) કાજળ
D) કર્મ

430. નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ?

A) 'ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો'
B) 'ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!'
C) 'ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળી'
D) 'અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખાં'

---

423)B, 424)A, 425)A, 426)A, 427)A, 428)C, 429)A, 430)D.

431. નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો:
સોનાના ઝાડ ભાળવા
A) સોનાનાં દાગીના મળવા
B) સોનાની વસ્તુ આંચકી લેવી
C) ખૂબ સમૃદ્ધિ જોવી
D) ઉપરમાંથી એકપણ નહીં

432. સંતો ! અમે રે વહેવારિયા રામનામના - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
A) સંખ્યાવાચક
B) રંગવાચક
C) ગુણવાચક
D) પરિમાણવાચક

433. નીચેનામાંથી ક્યો અલંકાર રૂપક અલંકાર નથી ?
A) મને રામરમકડું જડિયું, રાણાજી ! મને રામરમકડું જડિયું
B) બપોર એક મોટું શિકારી કૂતરુ છે
C) ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે
D) જળ એજ જીવન !

434. વિરુદ્ધાર્થી શબ્દોની યોગ્ય જોડ માટે ક્યો વિકલ્પ સાચો છે ?
A) ઉન્નતિ — 1) તેજ
B) ઉખર — 2) અવનતિ
C) દુર્ગંધ — 3) ફળદ્રુપ
D) તિમિર — 4) સુગંધ
5) અંધારુ

A) A-1, B-3, C-2, D-4
B) A-2, B-3, C-4, D-1
C) A-4, B-1, C-2, D-3
D) A-4, B-2, C-1, D-3

435. 'વિદ્યાર્થી' શબ્દની સંધિ છૂટી પાડો.
A) વિદ્યા + અર્થી
B) વિદ્ય + અર્થી
C) વિદ્યા + આર્થી
D) વિદ્ય+ આર્થી

436. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. - જળ
A) વાણી
B) વાચા
C) સલિલ
D) જરા

437. તળપદા શબ્દો અને શિષ્ટરૂપનું ક્યું જોડકું સાચું છે ?
A) વટે-રસ્તે
B) વેળા-વળવું
C) બકાલુ-શાકભાજી
D) હાકાવાકા- કરચલી કે ગેડ

---

431)C, 432)C, 433)C, 434)B, 435)A, 436)C, 437)C.

438. નીચેનામાંથી ક્યું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો.

A) વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! B) ગોપીઉને વા'લો કાનુડો

C) લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! D) આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે

439. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

A) પતિશત્રુતત્વ B) પ્રતિશત્રુતત્વ

C) પ્રતીશત્રુત્વ D) પ્રતિશત્રુત્વ

440. 'ઓઢું હું કાળો કામળો, દૂજો <u>ડાઘ ન લાગે</u> કોય' આ પદમાં રેખાંકિત રૂઢિ પ્રયોગોનો સાચો અર્થ તારવો.

A) મેલું થઈ જવું B) કલંક લાગવું

C) ધાબું પડી જવું D) કાળાશ આવી જવી

441. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

શું કરવું તે કશું સૂઝે નહિ તેવું

A) કિંકર્તવ્યમૂઢ B) મૂઢ

C) નસમજણું D) નાસૂઝણું

442. 'વમળ' શબ્દ ક્યા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે ?

A) કાદવમાં ઊગેલા કમળ માટે. B) પવનની લહેર માટે.

C) નદીના વળાંક માટે. D) વહેતા પાણીમાં થતા કુંડાળા માટે.

443. નીચેનામાંથી ક્યો સમાસ 'ઉપપદ' નથી ?

A) પાણીકળો B) ભયંકર

C) ગોપાળ D) ઘનશ્યામ

444. નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો ?

A) મનોરથ = મનુ + રથ B) વ્યસ્ત = વિ + અસ્ત

C) પૃથ્વી = પૃ + ઈથી D) યોગેશ = યોગા + ઈશ

445. કઈ જોડણી ખોટી છે ?

A) સ્વાભાવિક B) ખૂબસુરત

C) જિજ્ઞાસા D) ઐતિહાસિક

446. નીચેનામાંથી ક્યો શબ્દ સંમાનાર્થી નથી ?

A) પરોણો B) મહેમાન

C) અતિથિ D) યજમાન

---

438)B, 439)D, 440)B, 441)A, 442)D, 443)D, 444)B, 445)B, 446)D.

447. શબ્દકોશના ક્રમ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે ?

A) ઉપર, એકલવાયું, ચગડોળ, મરમ B) આવળ, બાવળ, બોરડી, આજે

C) ઘર, ચગડોળ, ઉપર, એકલવાયું D) ફૂલ, તપ, બગલો, નમસ્તે

448. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો.

A) માયાળુ B) મધુર

C) ચળકાટ D) સાંસારિક

449. ઉપનામ અને ઉપમેયને એકરૂપ દર્શાવતાં ક્યો અલંકાર બને ?

A) યમક B) શ્લેષ

C) રૂપક D) ઉપમા

450. નીચેનામાંથી ક્યો સમાસ કર્મધારય છે ?

A) ઘનશ્યામ B) દીવાદાંડી

C) જીવનયાત્રા D) નંદકુંવર

451. બહાનાં કરવાં - એ અર્થ માટે ક્યો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

A) ગપ્પાં મારવાં B) કુસ્તી ન કરવી

C) મુખ સિવાય જવું D) અખાડા કરવા

452. 'લિયે લાલો ને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો.

A) ખાડો ખોદે તે પડે.

B) એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ?

C) સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે.

D) એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે.

453. નાકલીટી ખેંચવી એટલે ?

A) આજીજી કરવી B) નાપાસ કરવો

C) નાક પર લીટી દોરવી D) હુકમ કરવો

454. 'તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.' - છંદ ઓળખાવો.

A) શાર્દૂલવિક્રીડિત B) મંદાક્રાન્તા

C) હરિગીત D) સવૈયા

455. કઈ સંધિ ખોટી છે ?

A) યથા + ઇચ્છ = યથેચ્છ B) સરસ્ + વર = સરોવર

C) ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક D) ઉન્નત = ઉદ્ + નત

447)A, 448)B, 449)C, 450)A, 451)D, 452)C, 453)A, 454)C, 455)C.

456. ક્યું વિરોધી જોડકું સાચું છે ?

A) ઉપજાઉ - ફળદ્રુપ
B) મંડન - સમર્થન
C) અધોગામી - ઉર્ધ્વગામી
D) સમૂહ - સમષ્ટિ

457. શબ્દકોશ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે ?

A) આંગણું, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ
B) લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણું
C) બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ
D) આંગણું, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ

458. કઈ કહેવતનો અર્થ છે કે થોડું કરતાં ભારે કામ પાર પડે ?

A) સંપ ત્યાં જંપ
B) કાંકરે કાંકરે પાળ બંધાય
C) ઝાઝા હાથ રળિયામણા
D) એક હાથે તાળી ન પડે

459. સાચી જોડણી શોધો.

A) આશિર્વાદ
B) આર્શીવાદ
C) આશીર્વાદ
D) આસિર્વાદ

460. અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

A) મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ.
B) મામા આવ્યા, લાવ્યા મજાની વાતો.
C) સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ.
D) સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો.

461. નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે ?

A) દોહરો
B) ચોપાઈ
C) હરિગીત
D) મનહર

462. નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?

A) રજની + ઈશ = રજનીશ
B) તથ + અપિ = તથાપિ
C) પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ
D) પો + અન = પવન

463. 'ઘુમટો તાણેલી સ્ત્રી' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

A) શિરમોર
B) લાજીતા
C) સરંગટ
D) નવોઢા

464. નીચેનામાંથી ક્યો શબ્દ - અવિકારી વિશેષણ છે ?

A) સસ્તી
B) ચતુર
C) સારી
D) મીઠું

---

456)C, 457)D, 458)B, 459)C, 460)C, 461)D, 462)B, 463)C, 464)B.

465. ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ક્યા વ્યંજનના વર્ગો છે ?

A) મૂર્ધન્ય
B) દંત્ય
C) કંઠ્ય
D) ઓષ્ઠ્ય

466. નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો.

A) ઉછંગ
B) ખોબો
C) ઉદક
D) સલિલ

467. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

A) નળ
B) બેડી
C) નાળ
D) લગામ

468. નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ?

A) યામિની
B) શર્વરી
C) દામિની
D) નિશા

469. સાચું બોલનાર ક્યાં છે ? - આ વાક્ય કર્તા-પદ બોલનાર એ શું છે?

A) કૃદંત
B) સંજ્ઞા
C) સર્વનામ
D) વિશેષણ

470. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દની સાચી વિભક્તિ જણાવો. <u>ઋતુમાં</u> ઋતુ એટલે વસંત.

A) પંચમી વિભક્તિ
B) તૃતીય વિભક્તિ
C) પ્રથમ વિભક્તિ
D) સાતમી વિભક્તિ

471. મુક્તિ શબ્દમાં કેટલા વ્યંજનો છે?

A) ત્રણ
B) બે
C) પાંચ
D) ચાર

472. પૂર્વ પ્રત્યય ક્યા શબ્દમાં છે?

A) શેઠાણી
B) સ્વામીજી
C) સુમધુર
D) બંધુત્વ

473. નીચેના વાક્યમાં પ્રયોજાયેલો સાચો કાળ જણાવો.

ગયા વર્ષે મોંઘવારી વધઈ ગઈ હતી.

A) સંપૂર્ણ ભૂતકાળ
B) સાદો ભૂતકાળ
C) ચાલુ ભૂતકાળ
D) સંપૂર્ણ વર્તમાનકાળ

465)B, 466)A, 467)C, 468)C, 469)A, 470)D, 471)A, 472)C, 473)D.

474. નીચે દર્શાવેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. અવજ્ઞા
A) ઉપેક્ષા
B) અપેક્ષા
C) તિતિક્ષા
D) આજ્ઞા

475. નીચેના શબ્દ સમૂહ માટેનો સાચો સામાસિક શબ્દ જણાવો. યશ આપનાર
A) યશદાયી
B) તેજસ્વી
C) યશોદા
D) યશસ્વી

476. શબ્દ સમૂહ માટેની એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી.
A) પોતાની જાત સાથેની છેતરપિંડી-આત્મવંચના
B) જેના પર તહોમત મૂકાયુ હોય તે-વાદી
C) વૃધ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું-અજરામર
D) સાવ અસંભવિત હોય તેવું-આકાશકુસુમવત

477. સમજયા વગર ખોટી આસ્થા હોવી તે શબ્દ સમૂહ માટે સમુચિત સામાસિક શબ્દ કયો છે?
A) અશ્રધ્ધા
B) અંધશ્રધ્ધા
C) અલ્પશ્રધ્ધા
D) અર્ધશ્રધ્ધા

478. નીચેના શબ્દસમૂહ માટેનો સાચો શબ્દ જણાવો. અભિમાનથી ફુલાઈ જનાર
A) ફુલણશી
B) અભિમાની
C) સ્વાભિમાની
D) મિથ્યાભિમાની

479. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જરૂર પૂરતું જ ખાનાર
A) ઓછું ખાનાર
B) અલ્પાહારી
C) મિતાહારી
D) નિરાહારી

480. આંખ મીચામણા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
A) આંખ ઉઘાડ-બંધ કરવી
B) તાકીતાકીને જોવું
C) જોયા પછી યાદ રાખવું
D) જોયું ન જોયું કરવું

481. આંખ ઉઘડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
A) આંખો ખુલ્લી થવી
B) પશ્ચાતાપ થવો
C) પરિસ્થિતિ સમજવી
D) ઉંઘમાંથી ઉઠવું

482. લક્ષ્મણ રેખા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
A) લક્ષ્મણે દોરેલી રેખા
B) લજ્જા
C) સીમા-રેખા
D) મર્યાદા

474)A, 475)C, 476)B, 477)B, 478)A, 479)C, 480)D, 481)C, 482)D.

483. ટાઢ-તડકા વેઠવાં રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

A) સુખ-દુઃખ સહન કરવાં
B) શિયાળો-ઉનાળો પસાર કરવો
C) ઠંડી-ગરમી સહેવી
D) અપમાન સહન કરવું

484. ધૂળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?

A) ધૂળ સાફ કરવી
B) ખૂબ ધમકાવવો
C) સફાઈ કરવી
D) ખૂબ પ્રશંસા કરવી

485. બહુ દુઃખ પડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે?

A) માથાનો ખેલ
B) માથે ઝાડ ઉગવા
C) માથું ઉંચું રાખવું
D) માથું હાથમાં રાખવું

486. આરોગ્ય બગડવું તેવો અર્થ નીચે કયા રૂઢિપ્રયોગનો થાય છે?

A) પાણી જોવું
B) પાણી લાગવું
C) પાણી વલોવવું
D) પાણી ફેરવવું

487. ચાર દિવસની ચાંદની રૂઢિપ્રયોગનો અર્થ આપો.

A) ચાર દિવસનું અજવાળું
B) અલ્પકાલીન દુઃખ
C) દીર્ઘકાલીન સુખ
D) થોડા સમયનું સુખ

488. કાને ધરવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

A) કાનમાં પહેરવું
B) વાત સાંભળવી
C) કાન ઉપર ધારણ કરવું
D) કહ્યા પર લક્ષ આપવું

489. આંખો ઠરવી રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) ઠંડીમાં આંખો ઠરી જવી
B) ટીકીટીકીને જોવું
C) જીવને શાંતિ થવી
D) આશ્ચર્યથી જોવું

490. માથું આપવું રૂઢિ પ્રયોગનો અર્થ શું થાય?

A) બલિદાન આપવું
B) માથું અર્પણ કરવું
C) માથા માટે માથું આપવું
D) સમર્પણ કરવું

491. નીચેના શબ્દસમૂહ માટેનો શબ્દ જણાવો.
ઘરમાં ચાલતો ઉદ્યોગ

A) લઘુ ઉદ્યોગ
B) ઘરઘરાઉ
C) ગલિતોદ્યોગ
D) ગૃહ ઉદ્યોગ

483)A, 484)B, 485)B, 486)B, 487)D, 488)D, 489)C, 490)A, 491)D.

492. હગો કરવો એવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે?

A) પગા પાછા પડવા
B) પગ ભારે થવા
C) પગ ભાંગવા
D) પગ પહોળા કરવા

493. નીચેના શબ્દસમૂહ માટેનો સાચો શબ્દ જણાવો. ઉપમાન ન આપી શકાય તેવું

A) નિરૂપમ
B) અનુપમા
C) અનુપમ
D) નિરૂપમા

494. નીચેના પૈકી કયો શબ્દ ધનનો પર્યાય નથી?

A) નિર્જર
B) અર્થ
C) વસુ
D) વિત્ત

495. નીચેના પૈકી કયો શબ્દ તલવારનો સામાનાર્થી નથી ?

A) અસિ
B) ચન્દ્રહાસ
C) કરતાલ
D) કરવાલ

496. અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય છે?

A) આઠ
B) ચાર
C) દસ
D) બાર

497. નીચેના પૈકી કયો શબ્દ જંગલનો સામાનાર્થી નથી ?

A) અરણ્ય
B) કાંતાર
C) ઉપવન
D) રાન

498. નીચેના પૈકી કયો શબ્દ ગંગાનો સમાનાર્થી નથી ?

A) કાલિન્દી
B) જાહ્નવી
C) ભાગીરથી
D) મંદાકિની

499. કયો શબ્દ કામદેવનો સમાનાર્થી નથી ?

A) કંદર્પ
B) મનોજ
C) રજનીશ
D) મન્મથ

500. નીચેના પૈકી કયો શબ્દ ઈચ્છાનો પર્યાયવાચી નથી ?

A) સ્પૃહા
B) કામના
C) ઝંખના
D) પ્રમોદ

492)D, 493)C, 494)A, 495)C, 496)A, 497)C, 498)A, 499)C, 500)D.

501. નામને બદલે પ્રયોજાય તેને શું કહેવામાં આવે છે?

A) વિશેષ
B) વિશેષણ
C) સર્વનામ
D)ક્રિયાવિશેષણ

502. નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. વિહંગ

A) તુરંગ
B) સુરંગ
C) પક્ષી
D) વિહગ

503. નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. થાપણ

A) પારકુંધન
B) મૂડી
C) અનામંત
D) અમાનત

504. નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શૃંગ

A) શીંગડું
B) શૃંગાર
C) શિખર
D) સિંગાર

505. નીચેના વાક્યમાં લીટી દોરેલાં શબ્દમાં રહેલા વિશેષણનો પ્રકાર જણાવો.
આ પ્રશ્નપત્ર ત્રણ કલાકનું છે.

A) ગુણવાચક
B) ક્રિયાપદ
C) કૃદંત
D) વિશેષણ

506. નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે?

A) સર્વનામ
B) ક્રિયાપદ
C) કૃદંત
D) વિશેષણ

507. નીચેના શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો. ધર્મિષ્ઠ

A) ધર્મ + ઈષ્ઠ
B) ધર્મિ + ઈષ્ઠ
C) ધર્મ + રિષ્ઠ
D) ધમ + ઈષ્ઠ

508. નીચેના દર્શાવેલ શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે?

A) સંન્યાસીની
B) અનુભુતિ
C) ઉંઘણશી
D) ચિચિયારી

509. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે?

A) શિર્શક
B) સિર્શક
C) શીર્ષક
D) શિર્ષક

501)C, 502)C, 503)B, 504)C, 505)B, 506)B, 507)A, 508)D, 509)C.

510. નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે?

A) છીછરૂં
B) ગિરફતાર
C) ચુંટણી
D) ક્ષણિક

511. નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે?

A) કારકીર્દી
B) ગણતરી
C) આલિશાન
D) ગણાત્રી

512. નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે?

A) આકૃતી
B) આબરૂ
C) આશિષ
D) અનૂભુતી

513. નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે?

A) ઉગમ
B) આરઝૂ
C) અર્વાચીન
D) ઉપાધી

514. નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.

નિઃ + દોષ

A) નિરદોષ
B) નીર્દોસ
C) નિર્દોષ
D) નીર્દોષ

515. જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

A) ઈન્દ્રવજ્રા
B) ઉપેન્દ્રવજ્રા
C) તોટક
D) ઉપજાતિ

516. નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.

પ્ર + અર્થ + ના

A) પ્રાર્થના
B) પ્રઅર્થના
C) પરઅર્થના
D) પ્રાથના

517. જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - આ પંક્તિનો છંદ ઓળખાવો.

A) ઝૂલણાં
B) હરિગીત
C) સવૈયા
D) અનુષ્ટુપ

510)C, 511)B, 512)C, 513)D, 514)C, 515)D, 516)A, 517)B.

518. નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.
ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ.

A) સ્ત્રગ્ધરા
B) મન્દાક્રાન્તા
C) શિખરિણી
D) શાર્દૂલવિક્રીડિત

519. પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો.

A) પવિત્ર
B) પુણ્ય
C) અગ્નિ
D) અપવિત્ર

520. નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી?

A) ક્ષિતિપાલ
B) મહીપાલ
C) ભૂદેવ
D) નૃપતિ

521. મહોરાના માણસ એટલે શું ?

A) કોઈ વ્યક્તિના પ્રતિનિધિ
B) જેનું સાચુ વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ
C) પડદા પાછળ રહીને કામ કરતો માણસ
D) સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ

522. નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

A) બીડું ઝડપવું – પડકાર ઝીલવો
B) લાલપીળા થવું – ખૂબ હસવું
C) વિસ્મૃતિ થવી – યાદ કરવું
D) રાવ કરવી – પ્રશંસા કરવી

523. અછોવાનાં કરવાનો અર્થ સ્પષ્ટ કરો.

A) ઘરમાંથી કાઢી મૂકવું
B) આળપંપાળ કરવી
C) ગુસ્સે થવું
D) અપશબ્દ બોલવા

524. ચીનનો શાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) પાકો ઠગિયો
B) દુષ્ટ માણસ
C) ચીન દેશનો વેપારી
D) ચતુર સુજાણ

525. ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો.

A) ગળ્યા પાણીથી સ્નાન કરવું
B) છેતરાવું
C) ધંધામાં ફાયદો થવો
D) ધાર્યા કરતાં ઊંધુ થવું

526. ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું
B) ખૂબ યુધ્ધ કરવું
C) તલવારની ધાર પર ચાલવું
D) બહાદુર દર્શાવવી

---

518)D, 519)D, 520)C, 521)B, 522)A, 523)B, 524)A, 525)B, 526)A.

527. કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) દુઃખી થઈ જવું
B) સ્વાભાવિક થઈ જવું
C) માથે પડવું
D) મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું

528. અન્નજળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

A) પૂરમાં પાક નષ્ટ થવો
B) દુકાળ પડવો
C) ભૂખે મરવું
D) જીવવા જેવી સ્થિતિ ન હોવી

529. નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી?

A) પાણીમાં લીટા કરવા
B) ફીફા ખાંડવા
C) ધુમાડાના બાચકા ભરવા
D) રજનું ગજ કરવું

530. નીચેના પૈકી કઈ કહેવત સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી નથી ?

A) લોભે લક્ષણ જાય
B) કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી
C) દોરડી બળે પણ વળ ન મૂકે
D) પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય

531. નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

A) ઉતાવળે આંબા ન પાકે
B) ધીરજના ફળ મીઠાં
C) પાકે ઘડે કાંઠા ન ચડે
D) ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર

532. નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

A) અધૂરો ઘડો છલકાય
B) ઉજળું એટલું દૂધ નહીં
C) ખાલી ચણો વાગે ઘણો
D) ખોટો રૂપિયો ચળકે ઘણો

533. નીચેના વાકયમાં વિશેષણ કયું છે? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી.

A) મીઠા
B) મૂળ
C) માનવતા
D) ઝાડ

534. નીચેના શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ક્રીડા

A) દુઃખ
B) સુખ
C) રમત
D) બગીચો

535. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે?

A) વીસંવાદ
B) વિસંવાદ
C) વીસવાંદ
D) વિસવાંદ

527)B, 528)D, 529)D, 530)A, 531)C, 532)B, 533)A, 534)C, 535)B.

536. હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે?
A) એકવીસ
B) બાર
C) સોળ
D) અઠ્ઠાવીસ

537. નીચેના શબ્દનો વિરૂધ્ધાર્થી શબ્દ જણાવો.
તિમિર
A) તેજ
B) સંધ્યાકાળ
C) ભળભાંખળું
D) અંધાર

538. ગર્ભશ્રીમંત-સમાસનો પ્રકાર દર્શાવો.
A) દ્વન્દ્વ
B) કર્મધારય
C) તત્પુરૂષ
D) મધ્યમપદલોપી

539. વીજળીવેગ-સમાસનો પ્રકાર દર્શાવો.
A) તત્પુરૂષ
B) કર્મધારય
C) દ્વન્દ્વ
D) ઉપપદ

540. મહત્વકાંક્ષા સમાસનો પ્રકાર દર્શાવો.
A) તત્પુરૂષ
B) મધ્યમપદલોપી
C) કર્મધારય
D) બહુવ્રીહિ

541. માથાબોળ સમાસનો પ્રકાર દર્શાવો.
A) તત્પુરૂષ
B) બહુવ્રીહિ
C) કર્મધારય
D) ઉપપદ

542. નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો.
A) કર્મધારય
B) તત્પુરૂષ
C) બહુવ્રીહિ
D) મધ્યમપદલોપી

543. નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. આગગાડી
A) દ્વિગુ
B) મધ્યમપદલોપી
C) દ્વન્દ્વ
D) કર્મધારય

544. કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે?
A) બહુવ્રીહિ
B) તત્પુરૂષ
C) કર્મધારય
D) ઉપપદ

---

536)D, 537)A, 538)C, 539)B, 540)B, 541)D, 542)C, 543)B, 544)B.

545. ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે?
A) રૂપક
B) અતિશયોક્તિ
C) ઉપમા
D) ઉત્પ્રેક્ષા

546. નીચેના વાક્યમાંથી ક્યુ પદ 'નિપાત' છે તે જણાવો.
'પ્રકૃતિ જ મારી મા રહી છે'
A) મા
B) જ
C) રહી
D) છે

547. 'આબરૂ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
A) અભિમાન
B) પદ
C) પ્રતિષ્ઠા
D) હોશિયાર

548. 'નારી'નો સમાનાર્થી શબ્દ જણાવો.
A) વનિતા
B) વસુધા
C) ધરણી
D) સરિતા

549. નીચેનામાંથી ક્યા શબ્દનો અર્થ 'વિદ્વાન' એવો થાય છે ?
A) માનુષ
B) ભૃત્ય
C) વરિષ્ઠ
D) પ્રાજ્ઞ

550. સાચી જોડણી શોધો
A) મશગૂલ
B) મસગુલ
C) મસગૂલ
D) મસ્ગુલ

551. નીચેનામાંથી .....પદ દ્વન્દ્વ સમાસ નથી
A) સેવા પૂજા
B) ઊંચુનીચું
C) ખાધુંપીધું
D) ગળેપડું

552. વિશેષણનો પ્રકાર નથી
A) ગુણવાચક
B) સંખ્યાવાચક
C) માપવાચક
D) સ્વવાચક

553. નામ-પરથી બનતા વિશેષણની સાચી જોડી નથી
A) રસ-રસિક
B) કૃપા-કૃપાળુ
C) માર-મારકણું
D) દયા-દયામણું

554. 'છોકરાં મેદાનમાં રમતાં હતા' એ વાક્યની રચના જણાવો.
A) કર્તરિ પ્રયોગ
B) કર્મણિ પ્રયોગ
C) ભાવે પ્રયોગ
D) કૃદંત પ્રયોગ

545)C, 546)B, 547)C, 548)A, 549)D, 550)A, 551)D, 552)D, 553)D, 554)A.